

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪, બુધવાર
વિક્રમ સંવત ૨૦૮૦, મહા સુદ પાંચમ

વર્ષ : ૧૫
અંક : ૧૯૪

તંત્રી : પટેલ સુરેશ રમણલાલ
અમદાવાદ

કિંમત : રૂ. ૨.૦૦
પાના : ૮

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ સહિતની માગ માટે ખેડૂતોનું આંદોલન

ખેડૂતોની કૂચથી હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર સ્થિતિ કાબૂ બહાર દિલ્હીમાં ઘૂસવા પર મક્કમ ખેડૂતોનો ટ્રેક્ટર વડે સિમેન્ટ બેરિકેડ હટાવવાનો પ્રયાસ



તહેનાત કરવામાં આવી છે. ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સાથે જોડતી તમામ સરહદો પર બેરિકેડ લગાવીને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેલ્થ લાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. દિલ્હીના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પ્રતિબંધોને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિતના NCR શહેરોમાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હ આસપાસની સરહદો સીલ, અનેક ખેડૂતોની અટકાયત

જ્યારે ખેડૂતોની દિલ્હી તરફ કૂચને કારણે મંગળવારે એનસીઆરમાં ભારે ટ્રાફિક જામ જેવા મળ્યો હતો, ત્યારે ગાઝીપુર બોર્ડર, સિંધુ બોર્ડર અને સંભુ બોર્ડર સહિતની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. જ્યારે ખેડૂતોએ મંગળવારે સંભુ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ. ખેડૂતોએ પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ફોનથી ટીચર ગેસના શેલ છોડ્યા હતા. ખેડૂતોના આંદોલનને લઈને એઆઈએમઆઈએમથીફ ઓપેસીએ કહ્યું કે મોટી સરકારે ખેડૂતોની માંગણીઓ પૂરી કરવી જોઈએ. આ સરકારની નિષ્ફળતા છે કે તે સતત સમયનો બગાડ કરી રહી છે. એમએસપી કાયદો જલ્દી લાગુ થવો જોઈએ. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ મંગળવારે કહ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે હું ખેડૂતોને વિનંતી કરું છું કે પર્થિવરણને બગાડવાનો પ્રયાસ કરી રહેલા આવા તત્વોથી સાવધ રહે. સ્વામીનાથન કમિશનના અહેવાલ દ્વારા ભલામણ કરાયેલ તમામ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) ની ભાંચધરી આપતો કાયદો બનાવવાની માંગ વિશે પૂછવામાં આવતા, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર આવી ઘણી બાબતો પર સંમત છે. અર્જુન મુંડા એવા મંત્રીઓની ટીમમાં સામેલ છે જેમણે ખેડૂત નેતાઓ સાથે વાત કરી હતી. આ ટીમમાં ખાદ અને ગાહક બાબતોના મંત્રી પીયૂષ ગોયલ, રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને પંજાબના મંત્રી કુલદીપ સિંઘ ધાલીવાલ પણ સામેલ છે. આ વખતે ખેડૂતોનું આંદોલન 'સંયુક્ત કિસાન મોરચા' અને 'પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ' દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને જોતા વહીવટીતંત્રે દિલ્હીની તમામ સરહદો સીલ કરી દીધી છે. અર્ધલશ્કરી દળના જવાનો સરહદ પર તૈનાત છે. ખેડૂતો તમામ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) ની ખાતરી આપતા કાયદાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત મનરંગા હેઠળ દર વર્ષે ૨૦૦ દિવસની રોજગારી અને ૭૦૦ રૂપિયા દૈનિક વેતન આપવાની અપીલ કરવામાં આવી

છે.ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને કારણે આજે રાષ્ટ્રીય રાજધાનીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. સોમવારે ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની બેઠક લગભગ પાંચ કલાક સુધી ચાલી હતી, પરંતુ ખેડૂતોને (કિસાન આંદોલન) સમજાવવાના તમામ સંભવિત પ્રયાસો અનિષ્ઠિત રહ્યા હતા. દિલ્હીની તમામ સરહદોને કેન્ટોનમેન્ટમાં ફેરવી દેવામાં આવી છે.

ન્યૂઝ ડિસ્ક

કોંગ્રેસ એમએસપીને કાયદાકીય ગેરંટી આપશે : રાહુલ ગાંધી



। નવી દિલ્હી, તા.૧૩ ।

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ તેમની માંગણીઓ સાથે સેંકડો ખેડૂત સંગઠનોના સમર્થનમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દબાણ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે.દરમિયાન રાહુલ ગાંધીએ આ ખેડૂતોને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસ દરેક ખેડૂતની સાથે છે અને ખેડૂતોને કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે.

ન્યૂયોર્કના સભવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબાર, એકનું મોત

। ન્યૂયોર્ક, તા.૧૩ ।

અમેરિકામાં આડેવડ ગોળીબારની ઘટનાઓ રોકવાનું નામ જ નથી લઈ રહી. અમેરિકાના ન્યૂયોર્ક સિટી સભવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતી જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઘટના સોમવારે બની હતી.

ખેડૂતોની દિલ્હી કૂચની વચ્ચે કિશાન નેતાના સરકાર પર પ્રહાર દેશમાં મોટી મૂડીવાદી કંપનીઓએ એક રાજકીય પક્ષ બનાવી લીધો : રાકેશ ટિકેટ

સરકારે અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ, સરકારે આ મુદ્દે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ : ખેડૂત નેતા

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૩ । દિલ્હીમાં ખેડૂતોનું ઉચ્ચ આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પોલીસ પણ ટીચર ગેસના શેલ છોડી તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકેટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધી મોટી પ્રતિક્રિયા આપી છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટે કહ્યું કે, 'દેશમાં મોટી મૂડીવાદી

કંપનીઓ છે... તેમણે એક રાજકીય પક્ષ બનાવી લીધો છે અને આ દેશ પર કબજો કરી લીધો છે. આવી સ્થિતિમાં સમસ્યાઓ આવશે જ... જો તેમની (ખેડૂતો) સાથે કોઈ અન્યાય થશે, સરકાર તેમના માટે કોઈ સમસ્યા ઊભી કરશે તો ખેડૂતો પણ આપણાથી દૂર નથી અને દિલ્હી આપણાથી દૂર નથી.' તેમણે કહ્યું કે, 'જ્યારે દિલ્હીમાં ૧૩ મહિના સુધી ખેડૂત આંદોલન ચાલ્યું હતું, ત્યારે અમારી અને સરકાર વચ્ચે ૧૨

વખત વાતચીત થઈ હતી. ત્યારબાદ ૨૨ જાન્યુઆરી-૨૦૨૧ બાદ ભારત સરકાર સાથે અમારી કોઈ વાતચીત થઈ નથી. હવે ત્રણ વર્ષ બાદ આ વાતચીત શરૂ થઈ છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સરકારે અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ. સરકારે આ મુદ્દે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ. ઉપરાંત તેનું નિરાકરણ લાવવું જોઈએ.'

આજે BAPS મંદિરનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન મોદીનો UAE પ્રવાસનો કાર્યક્રમ ટુંકાવાયો

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૩ । ખરાબ હવામાનને કારણે, UAEના અબુ ધાબીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આયોજિત 'અહલાન મોદી' સમુદાય કાર્યક્રમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. સોમવારે રાત્રે ભારે વરસાદને કારણે કાર્યક્રમ ટુંકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુએઈમાં ભારે વરસાદને કારણે સમગ્ર દેશમાં ટ્રાફિક જામ અને પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. તેથી આ પગલું ભરવું પડ્યું. અબુ ધાબીના

પ્રેમસબંધ સંદર્ભે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો બ્રેકઅપ બાદ પ્રેમિકાને માતા-પિતાની મરજીથી લગનની સલાહ ગુનો નથી : સુપ્રીમ

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૩ । સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બ્રેકઅપ પછી પ્રેમિકાને તેના માતા-પિતાની ઈચ્છા મુજબ લગન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નથી. પોતાની પ્રેમિકાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી એક યુવકને નિર્દોષ જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.જસ્ટિસ વિક્રમનાથ અને કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે જણાવ્યું હતું કે માત્ર સાથી/મિત્રને માતા-પિતાની સલાહ પર લગન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાના

ગુના સમાન નથી. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે કલમ ૩૦૬ હેઠળ ગુનો નોંધાયો નથી. ખંડપીઠે આરોપો અને કાયદાને ધ્યાનમાં લીધા બાદ કહ્યું હતું કે અપીલકર્તાની કોઈ સક્રિય ભૂમિકા નથી. આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કૃત્યો હોવા જોઈએ. આ મામલામાં જ્યારે છોકરાના પરિવારજનોએ કન્યાની શોધ શરૂ કરી ત્યારે પીડિત છોકરી નારાજ થઈ ગઈ અને તેણે આત્મહત્યા કરી હતી. આ પછી પોલીસે યુવક સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ કેસ નોંધ્યો હતો.

ઈન્દોર પોલીસે લાકોપતિ ભિખારણને ઝડપી મહિલાએ સંતાનો પાસેથી ભીખ મંગાવીને છ સપ્તાહમાં અટ્ટી લાખની કમાણી કરી

। (એજન્સી) ઈન્દોર, તા.૧૩ । એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, ૨૦ હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને ફક્ત છ અઠવાડિયામાં અટ્ટી લાખ રૂપિયા કમાણી. આ કોઈ નોકરિયાત વર્ગની સંપત્તિ નથી પરંતુ એક ભીખારણની છે, જે તેણે પોતાના સંતાનો પાસે ભીખ મંગાવીને ઊભી કરી છે. ઈન્દોર પોલીસે હાલમાં જ આ મહિલાને કસ્ટડીમાં લીધી છે. ઈન્દોર નામની આ મહિલાને સોમવારે રિમાન્ડ પર જેલમાં મોકલી

દેવાઈ છે. ઈન્દ્રા બાઈ પોતાની દીકરી પાસે પણ બળજબરીપૂર્વક ભીખ મંગાવતી હતી. ત્યારે તેની આ દીકરીને એક એનજીઓપાતે મોકલી દેવામાં આવી છે.આ મહિલાએ ભીખ માગીને આટલી મોટી રકમ ઊભી કરી છે તે જાણીને પોલીસ અને જિલ્લાના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. સંસ્થા પ્રવેશ નામના એનજીઓના સ્વયંસેવકો સાથે દલીલ કરતાં ઈન્દ્રા બાઈએ કહ્યું, ભૂખે મરવા કરતાં અમે ભીખ માગવાનું પસંદ કર્યું.

સમાચાર પત્ર છે લોકતંત્રનો ચૌથો સ્તંભ અને પ્રાણ, જે કહે છે એક લોકતંત્રનો નિર્માણ !

CHANNEL NINE NETWORK GUJARAT

◆ ન્યૂઝ પેપર, ◆ ન્યૂઝ ચેનલ, ◆ ન્યૂઝ વેબસાઈટ

આજે જ cnngujarat.com વેબસાઈટ ઉપર વિખીટ કરો અને જોડાઈ જાઓ સમાચારની દુનિયા સાથે...

LIVE cnngujarat.co.in

૧૭થી ૨૧ ફેબ્રુઆરી સુધી દરમિયાન ચાંદલોડિયા બી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે કોસિંગ નંબર ૩ બંધ રહેશે

અમદાવાદ, તા. ૧૩ | પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા બી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે આવેલું રેલવે કોસિંગ નંબર ૩ કિ.મી. ૫૦૮/૦૮-૦૮ (વંદેમાતરમ-ગોતા) ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી રેલવે ટ્રેક સમારકામ માટે બંધ રહેશે. રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન ગોતા બ્રિજ જગતપુર દ્વારા મુસાફરી કરી શકે છે.

પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા

અમદાવાદ, તા. ૧૩ | પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રકારે છે:

- ટ્રેન નંબર ૦૮૪૫૫ સાબરમતી-ભુજ સ્પેશિયલ જેને પહેલાં ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી વધારી દેવામાં આવી છે. ૨. ટ્રેન નંબર ૦૮૪૫૬ ભુજ-સાબરમતી સ્પેશિયલ જેને પહેલાં ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી વધારી દેવામાં આવી છે. ટ્રેન નંબર ૦૮૪૫૫ અને ૦૮૪૫૬ ના વધારેલા ફેરાનું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર ખુલ્લું છે.

સિટી સ્કેન મશીનમાં ઈન્જેક્શનના ઓવરડોઝથી બાળકોનું મોત થયું

અમદાવાદ, તા. ૧૩ | સુરતમાં ફરી એકવાર બેદરકારીથી માસુમ બાળકોનું મોત નિપજ્યાનો આક્ષેપ થયો છે. સુરતમાં ૬ વર્ષની બાળકોનું સિટીસ્કેન કરતી વખતે અચાનક મશીનમાં જ બેભાન થયા બાદ બાળકોનું મોત નિપજ્યું છે. ભરૂચથી સુરતની ખાનગી હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ૬ વર્ષની બાળકોનું સિનજી ઈમેજિંગ સિટીસ્કેન સેન્ટરમાં લઈ જવાઈ હતી, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ એક ગંભીર ઘટના છે. ભરૂચના સીતાપોણ ગામમાં રહેતા ઈમરાનભાઈ પટેલ પ્લમ્બીંગનું કામ કરે છે. તેમની ૬ વર્ષની દીકરી સફાને કાનમાં સાંભળવાની તકલીફ હતી. તેથી તેને સુરતની શ્રુતિ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.



દેશભરમાં આજે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવશે ત્યારે એક શોપની બહાર લગાવેલ હાર્ટના બલૂન લોકો ખરીદતા નજરે પડે છે.

આશરે ૨૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર સહકાર ભવન અને ગોડાઉન સાણંદ પંચકના ખેડૂતો માટે ઉપયોગી નીવડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાણંદ ખાતે 'ડો. શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન' અને ગોડાઉનનું ભૂમિપૂજન કરાયું

અમદાવાદ, તા. ૧૩ | મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ડો. શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન અને ગોડાઉનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ખેડૂતો અને સહકારી આગેવાનોએ મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પણ ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.



આ સહકાર ભવન અને ગોડાઉન આશરે ૨૪ કરોડના ખર્ચે સુવિધાયુક્ત બનાવવામાં આવશે. નિર્માણ થનાર સહકાર ભવનની વિશેષતાની વાત કરીએ તો, આ સહકાર ભવન આશરે ૧૦૨૪૪.૭૭ ચો.મી. વિસ્તારમાં હશે. આશરે ૧૬૧ જેટલી દુકાનો આ ભવનમાં બનાવાશે. ચાર માળના આધુનિક ભવનમાં તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત બિલ્ડિંગમાં રૂફ ટોપ સોલાર સિસ્ટમની પણ સુવિધા હશે. અહીં નિર્માણ પામનાર ગોડાઉન

આશરે ૨૪૯૨.૭૪ ચોમી વિસ્તારમાં નિર્મિત થશે, જેના કુલ ૮ યુનિટ હશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, સહકાર સેલના કન્વીનર શ્રી બીપીનાભાઈ પટેલ, સાણંદ એપીએમસી ચેરમેન શ્રી ખેંગારભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, હર્ષદગીરી ગોસ્વામી સહિતના રાજકીય આગેવાનો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, પદાધિકારીઓ, એપીએમસીના ડાયરેક્ટરશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અડધી રાતે હાઈવે પર રોકાવી બસ અમદાવાદથી રાજપીપળા પરત જતાં જાનૈયાઓને ફૂડ પોઈન્ટનિંગની અસર

અમદાવાદ, તા. ૧૩ | ખેડા પાસે એક લગ્ન પ્રસંગમાં ચોકાવનારી ઘટના બની હતી. રાજપીપળાથી આવેલા જાનૈયાઓને ફૂડ પોઈન્ટનિંગની અસર થઈ હતી. લગ્નમાં જમ્યા બાદ એકસાથે ૪૫ જેટલાં જાનૈયાઓને અસર થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એટલું જ નહિ, નવવધૂને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે આ ઘટના બની હતી. ચાલુ બસમાં જાનૈયાઓને ઉલ્ટી સાથે પેટમાં દુખાવો ઉપ ઝ્યો હતો, એક પછી એટ જાનૈયાઓની તબિયત બગડવા લાગતાં એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની તબિયત સુધારા પર છે. મહત્વનું છે કે અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જમણવાર પછી પરિવાર રાજપીપળા જવા માટે રવાના થયો હતો. આ દરમિયાન નડિયાદ ટોલબૂથ પાસે વારકરતી તમામ

જાનૈયાઓને ઉલ્ટી અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. તમામ લોકોને તબિયત બગડવા લાગતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. જેની મદદથી તમામ લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ટોલ પાસે આ ઘટના બની હતી. સોમવારે મોડી રાતે લગ્ન સમારોહ પૂરો કરીને જાનૈયાઓ બસમાં અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહ્યા હતા, ત્યારે જતા સમયે નડિયાદ પાસે આ ઘટના બની હતી. અમદાવાદ ખાતે લગ્ન સવાર જાનૈયાઓને પેટમાં દુખાવો લાગ્યું હતું. ચાલુ બસમાં જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર શરૂ થઈ હતી અને ઝાડા ઉલ્ટી શરૂ થયા હતા. ચાલુ બસ માં અચાનક તમામ જાનૈયાઓને ઝાડા ઉલ્ટી અને પેટ માં દુખાવો થતા નડિયાદ ટોલબૂથ પાસે બસ ઊભી રાખવામાં આવી.

ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાની માગ આગામી લોકસભા ચૂંટણી EVના સ્થાને બેલેટ પેપરથી કરવા માગ

અમદાવાદ, તા. ૧૩ | આદિવાસી પેઢી સ્થિત ડાંગ જિલ્લાની ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના કાર્યકરો દ્વારા ભારત દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે. આગામી લોકસભા ચૂંટણી નજીકના સમયમાં યોજનાર છે ત્યારે આ ચૂંટણીમાં ઈફર ના સ્થાને બેલેટ પેપરનો ઉપયોગ કરવા માંગ કરવામાં આવી છે. ભારતી ટ્રાયબલ ટાઈગર સેના ડાંગ દ્વારા પ્રમુખ નિલેશ જાખરે ની આગેવાની હેઠળ ડાંગ કલેક્ટર ને આવેદન પત્ર આપતા જણાવવાનું કે, અમેરિકા, જાપાન, પાકિસ્તાન, નેધરલેન્ડ, આયલેન્ડ જેવા દેશોમાં આજે ત્યાં લોકશાહીનાં માધ્યમથી બેલેટ પેપરથી ચૂંટણી થાય છે અને ભારતમાં લોકસભાની અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ કે તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી થવી જોઈએ. ભારતથી વધુ વિકસીત અન્ય બીજા દેશમાં જો બેલેટ પેપરથી થાય છે

ત્યાં ઈલેક્ટ્રીક વોટીંગ મશીનથી ચૂંટણી થતી નથી તો તેનો અર્થ એ થાય છે કે માનવ નિર્મિત ઈલેક્ટ્રીક વોટીંગ મશીન ઉપર તેઓને ભરોષો નથી. આ સાથે લોકશાહી બચાવવા માટે ઈલેક્ટ્રીક વોટીંગ મશીનની જગ્યા ચૂંટણી બેલેટ પેપરથી થાય તેવી માંગ કરાઈ છે. લોકોની માંગ છે કે આવનાર લોકસભાની ચૂંટણી ૨૦૨૪માં મશીન હટાવીને બેલેટ પેપર થી થાય એ જરૂરી હોવાનું કહેવામાં આવ્યું છે. આ આવેદનપત્ર આપતી વેળાએ બીટીટીએસ ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ૧૯૮૦ ના દાયકામાં, ભારતના ઘણા વિસ્તારોમાં બૂથ કેમ્પરિંગ અને બોગસ મતદાન જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઈલેક્ટ્રીક વોટીંગ મશીન (EVM) નો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ આજે ભારતમાં સંસદીયથી લઈને મ્યુનિસિપલ ચૂંટણી સુધીની ચૂંટણીઓમાં કરવામાં આવે છે.

વિશેષ અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં ખેડૂતો માટેની સિંચાઈ સુવિધાનો ૪૦ વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૭૦૦ કરોડથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૪૦૨ કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૭૦૦ કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું. આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈની જોડીએ દેશના નાગરિકોને સુર-રાજ્ય ગવર્નન્સની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. દેશના આ બે સપુત્રોએ છેવાડાના માનવી સુધી કેવી રીતે વિકાસ પહોંચી શકે, એ દેશ અને દુનિયાને બતાવ્યું છે, જેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે એક જ દિવસમાં રૂપિયા ૭૦૦ કરોડથી વધુના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે. આ સાથે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત થકી આ વિસ્તારના ૪૦ વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે



ખેડૂતોને પાણી મળી રહે એ માટે રૂ. ૪૦૨ કરોડના ખર્ચે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કામ માટેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે અને આ કામ પૂર્ણ થવાથી આ નળકાંઠા વિસ્તારના ૮૩ ગામોને નર્મદાનું પાણી મળતું થશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના લોકાર્પણની વાત કરતા કહ્યું કે, ૧૦મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧ લાખ ૩૨ હજાર જેટલા પ્રધાનમંત્રી

આવાસનું લોકાર્પણ કર્યું અને ૧૦ લાખ લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહના સંસદીય વિસ્તારમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ- ઓડા દ્વારા સાણંદ ખાતે રૂપિયા ૮૩.૮૧ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવી રહેલા ૭૫૬ ઈ.ડબલ્યુ. એસ આવાસનો રૂં સંપન્ન થયો છે. શ્રી અમિત શાહના સંસદીય વિસ્તારમાં થયેલાં વિકાસ કામોની વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, છેવાડાના માનવી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય કે પછી રોડ, રસ્તા જેવા કોઈપણ

પ્રજાલક્ષી કામ હોય શ્રી અમિત શાહે હંમેશાં દરેક કામને પ્રાધાન્ય આપીને સમયસર તેને પૂર્ણ કર્યું છે. આપના દેશનું ધ્યાન રાખવાની સાથે શ્રી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારનું પણ એટલું જ ધ્યાન રાખી રહ્યા છે. તેમણે પોતાના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પર્યાવરણ અનુરૂપ કુલ ૨૩,૦૦૦થી વધુના વિકાસ કામોની ભેટ નાગરિકો તેમજ ગ્રામજનોને આપી છે. આ પ્રસંગે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પર વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી વાકેફ છે. એટલું જ નહીં વરસાદની પેટન પણ બદલાઈ ગઈ છે ત્યારે આવા સંજોગોમાં વૃક્ષો વાવવા અને વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે એવી અપીલ પણ ગ્રામજનોને કરી હતી. આ સાથે ગાંધીનગર લોકસભા દેશની સર્વશ્રેષ્ઠ લોકસભા બને એ દિશામાં તમામ કામો થઈ રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મૂકેશ પુરીએ કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ સુવિધા માટે પાણી મળી રહે એ માટે પ્રથમ ફેઝનું રૂ. ૪૦૨ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત સંપન્ન કર્યું છે. સિંચાઈ સુવિધા માટે ખેડૂતો દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી

હતી ત્યારે રાજ્ય સરકારે આ નળકાંઠા વિસ્તારને નર્મદા કમાન્ડમાં સમાવેશ કરીને ખેડૂતોને સિંચાઈ સુવિધા માટે પાણી પૂરું પાડ્યું છે. એટલું જ નહીં બે તબક્કામાં આ કામ પૂર્ણ થશે, જેના માટે અંદાજિત કુલ રૂ. ૧૪૨૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. પ્રથમ ફેઝમાં રૂ. ૪૦૨ કરોડના ખર્ચે તેમજ બીજા ફેઝમાં રૂ. ૧૦૨૭ કરોડના ખર્ચે કેનાલના નેટવર્કનું કામ પૂર્ણ કરી ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના નળકાંઠાના છેવાડાના ગામોને નર્મદા કમાન્ડમાં સમાવેશ કરી પાઈપલાઈન અને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવા માટે નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી છે. આ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૪૦૨ કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. આ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા મળવાથી અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠાના કુલ ૩૯ જેટલા ગામોને લાભ મળશે. જેમાં અંદાજે કુલ ૩૫૦૦૦ હેક્ટરમાં સાણંદ તાલુકાના ૧૪ ગામો, બાવળા તાલુકાના ૧૨ ગામો અને વિરમગામ તાલુકાના ૧૩ ગામોનો સમાવેશ થાય છે.

લોક સ્ક્રીનથી જ સ્થામ મેસેજને બ્લોક કરવાનું વોટ્સએપમાં ફીચર



! (એજન્સી) નવી દિલ્હી, તા.૧૩ | આજના ભાગદોડના સોશિયલ મીડિયામાં તમારા મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવાની શ્રેષ્ઠ રીત વોટ્સએપ છે. તેમજ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરતું રહે છે, જેનાથી યૂઝર્સનો આ મેસેજિંગ પ્લેટફોર્મથી લગાવ જળવાઈ રહે છે. તેમજ આ નવા ફીચર્સ યુઝરને સારા અક્સપીરિયન્સને શ્રેષ્ઠ બનાવે છે. તાજેતરમાં જ કંપનીએ લોક સ્ક્રીનથી જ સ્થામ મેસેજને બ્લોક કરવાનું ફીચર ઉમેર્યું છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ટૂંક સમયમાં એક નવું અપડેટ બહાર પાડશે જે યુઝરને તેમની ચેટ્સને લોક કરેલ ડિવાઈસ પર સુરક્ષિત રાખવામાં મદદ કરશે. પહેલા એક કરતા વધુ ડિવાઈસ પર વોટ્સએપ યુઝ કરવામાં ઘણી મુશ્કેલીઓ થતી. પરંતુ આ નવા ફીચર આ પ્રક્રિયા સરળ બનાવી છે. જે યુઝરને એકથી વધુ પ્લેટફોર્મ પર સરળતાથી મેસેજ વાંચવા અને રિપ્લે કરવા સરળ બનાવે છે. જ્યારે યુઝર એક ડિવાઈસ પર ચેટને લોક કરે છે, ત્યારે તે વેબ, વિન્ડોઝ અને મેકઓએસપ્લેટફોર્મ સહિત તમામ લોક કરેલ ડિવાઈસ પર લોક થઈ જશે. લોક કરેલ ડિવાઈસમાંથી લોક કરેલ ચેટ્સને અક્સેસ કરવા માટે, યુઝરને પાસવર્ડ નાખવાનો જરૂરી છે. હાલ આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે. જો કે આ ફીચરના રોલઆઉટ માટે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.

પાંચ ભારતીય રાજ્યો આકર્ષણનું કેન્દ્ર બનશે
ભારત ટેક્સ ૨૦૨૪, ભારતનો અગ્રણી વૈશ્વિક ટેક્સટાઈલ મહોત્સવ

ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની પ્રતિષ્ઠિત હાથશાળ અને હસ્તકલા પરંપરાઓના ભવ્ય સંગમનું સાક્ષી બની શકશે

! (એજન્સી) નવી દિલ્હી, તા.૧૩ | ભારત ટેક્સ ૨૦૨૪, ભારતનો અગ્રણી વૈશ્વિક ટેક્સટાઈલ મહોત્સવ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની પ્રતિષ્ઠિત હાથશાળ અને હસ્તકલા પરંપરાઓના ભવ્ય સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. કલાત્મક ઉત્કૃષ્ટતા, વિશિષ્ટ હાથશાળની કારીગરી અને વિશિષ્ટ ટેક્સટાઈલ નવીનતાઓનું સહિયારું વર્ણન પ્રદર્શિત કરીને પાંચ ભારતીય રાજ્યો આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર 'ભાગીદાર રાજ્ય' તરીકે સમાવેશ સાથે, ભારત ટેક્સ ૨૦૨૪ ગુજરાત, તેલંગાણા અને મધ્ય પ્રદેશને 'સહાયક ભાગીદાર રાજ્યો' તરીકે સામેલ કરવાની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને આસામ પ્રમુખ વૈશ્વિક ટેક્સટાઈલ કાર્યક્રમમાં રાજ્ય મંડપ સ્થાપશે. મધ્યપ્રદેશની પ્રતિષ્ઠિત બાટિક પ્રિન્ટિંગ, હેન્ડ-બ્લોક પ્રિન્ટિંગ, ચંદેરી અને મહેશ્વરી સિલ્ક, ગુજરાતની બાંધણી, પટોળા સિલ્ક, હેન્ડ-પેઇન્ટિંગ, ઉત્તર પ્રદેશની ચિકનકારી, જરી-ઝરદોઝી, મહારાષ્ટ્રની પેઇશી સાડી, વરલી કલા, આંધ્રપ્રદેશની મશરૂ અને હિમરૂ-પ્રશંસનીય જ્યુટ, હાથથી દોરેલી કલમકારી, ભવ્ય હાથથી વણેલી ધર્માવરમ સાડીઓ અને સરસ મંગલગીરી સુતરાઉ વણાટ, ભારત



ટેક્સ ૨૦૨૪ વૈશ્વિક સ્તરે વખાણાયેલી રાજ્યોની હસ્તકલા અને હાથશાળ પરંપરાઓ અને નીતિઓ, નવીન તકનીકી અને આગામી ટેક્સટાઈલ પાર્ક જેવી પહેલના સંદર્ભમાં રાજ્યની પ્રગતિશીલ પહેલ પર ગૌરવ લેશે. રાજ્યની ભાગીદારી પર ટિપ્પણી કરતા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન, એકનાથ સંભાજી શિંદેએ કહ્યું, "ભારત ટેક્સ ૨૦૨૪ માં ભાગીદાર રાજ્ય તરીકે મહારાષ્ટ્રની સહભાગિતાના જાહેરાત કરતાં મને ગર્વ થાય છે. ભારતમાં સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન તરીકે, આ ઈવેન્ટ ઉદ્યોગ સહયોગ અને નવીનતા માટેનું સૌથી મોટું મંચ બની રહ્યું છે. મધ્યપ્રદેશને 'સહાયક ભાગીદાર રાજ્ય' તરીકે જોડાવા અંગે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, ડૉ. મોહન યાદવે કહ્યું, "મધ્યપ્રદેશની સમૃદ્ધિ તેના ઉદ્યોગોની પ્રગતિમાં રહેલી છે. ઉદ્યોગોની સ્થાપનાથી રોજગારીની તકોમાં વધારો થાય છે. રાજ્ય સરકાર એક કાર્યક્ષમ વ્યવસ્થા

સ્થાપિત કરવા, સુશાસનને પ્રોત્સાહન આપવા અને સર્વગ્રાહી વિકાસ સાધવા માટે સમર્પિત છે." ગુજરાત 'સહાયક ભાગીદાર રાજ્ય' તરીકે સામેલ થવા પર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, "ગુજરાત માટે, ટેક્સટાઈલ એ માત્ર એક ઉદ્યોગ નથી, પરંતુ એક પરંપરા અને વારસો પણ છે જે અમે અમારા હસ્તકલા અને મશીનોના જાદુ દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરીએ છીએ. ટેક્સટાઈલ ક્ષેત્રની વૃદ્ધિ ભારતની વૃદ્ધિ અને રોજગારીની તકનીકી વૃદ્ધિમાં રહેલો છે. ભારત ટેક્સ ૨૦૨૪ના હાર્ટમાં ટેક્સટાઈલના ઉત્સાહને વધુ ફેલાવતા, છબીકારો અને ડિઝાઇનરો માટે તેમની અમીટ છાપ છોડવાની અને ઈતિહાસનો એક ભાગ બનાવવાની અનન્ય તક રહેલી છે. કાપડ મંત્રાલય સત્તાવાર માયગવ વેબસાઇટ પર ભારત ટેક્સ મેમેન્ટો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે, જે ભારત ટેક્સમાં 'ટ્રેડ્સ ઓફ ટ્રેડિશન એન્ડ ઈનોવેશન' વિષય પર કેન્દ્રિત છે. પ્રથમ વિજેતાને ૧૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે, ત્યારબાદ બીજા અને ત્રીજા વિજેતાને અનુક્રમે ૩,૦૦૦ રૂપિયા અને ૨,૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે. ભારત ટેક્સ ૨૦૨૪ દરમિયાન આદરણીય મહાનુભાવો સમક્ષ વિજેતા ડિઝાઇન રજૂ કરવામાં આવશે.

RBIએ બનાવ્યો નવો પ્લાન
ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે હવે OTPની જરૂર નહીં પડે!
આરબીઆઈ વધુ એક સુરક્ષા પદ્ધતિ લાવવાનું વિચારી રહી છે, તેના દ્વારા ગ્રાહકોના ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને સુરક્ષા મળશે

! (એજન્સી) નવી દિલ્હી, તા.૧૩ | ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા ઇન્ટરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. આને રોકવા માટે આરબીઆઈ સમયાંતરે કામ કરતી રહે છે. હવે આરબીઆઈ ઓનલાઇન ઇન્ટરપિંડી રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવવા જઈ રહી છે, જેથી તમારે પેમેન્ટ કરવા માટે OTPની જરૂર નહીં પડે. હાલમાં, કોઈપણ જગ્યાએ કોઈપણ ઓનલાઇન વ્યવહાર કરવા માટે, તમને ચકાસણી માટે SMS દ્વારા OTP પ્રાપ્ત થાય છે. આ OTP પદ્ધતિ એ સુનિશ્ચિત કરે છે કે ઓનલાઇન પેમેન્ટમાં કોઈ ખલેલ કે ઇન્ટરપિંડી ન થાય. OTP નો સૌથી સામાન્ય



વિકલ્પ ઓથેન્ટિકેટર એપ છે. આ માટે વપરાશકર્તાઓને તેમના મોબાઇલ ફોન પરની અન્ય એપ્લિકેશનમાંથી પાસવર્ડ પદ્ધતિ એ સુનિશ્ચિત કરે છે કે ઓનલાઇન પેમેન્ટમાં કોઈ ખલેલ કે ઇન્ટરપિંડી ન થાય. OTP નો સૌથી સામાન્ય

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા
શેફિલ્ડમાં મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની ગોળી મારીને હત્યા

! (એજન્સી) અલાબામા, તા.૧૩ | અમેરિકામાં વધુ એક ગુજરાતીની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં પોતાની મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલને ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે તેમની જ મોટેલમાં ગોળી મારવામાં આવી હતી. આ મામલામાં પોલીસે ૩૪ વર્ષના વિલિયમ મૂરે નામના એક અમેરિકન યુવકની ધરપકડ કરી છે. શેફિલ્ડ પોલીસના જણાવ્યા અનુસાર, પ્રવીણ પટેલ હિલકેસ્ટ મોટેલના માલિક હતા, જેમના પર વિલિયમ મૂરે સવારે ગોળી ચલાવી હતી. પ્રવીણ પટેલને ગોળી



માર્ચા બાદ ઘટનાસ્થળ પરથી ભાગી ગયેલા હત્યારાને પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી લીધો હતો. લોકલ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, વિલિયમ મૂરે પ્રવીણ પટેલની મોટેલમાં રૂમ લેવા માટે આવ્યો.

વડાપ્રધાન બન્યા બાદ મોદીની યુએઈની સાતમી મુલાકાત
ઈન્દિરા ગાંધી બાદ યુએઈ જનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન



! (એજન્સી) નવી દિલ્હી, તા.૧૩ | વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (મંગળવાર) બે દિવસ સુધી યુએઈના પ્રવાસે રહેશે. ૧૩ અને ૧૪ ફેબ્રુઆરીએ જ્યારે વડાપ્રધાન યુએઈ જઈ રહ્યા છે તો એ નોંધવું જોઈએ કે ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની સાતમી મુલાકાત હશે. આ સિવાય છેલ્લા ૮ મહિનાઓમાં વડાપ્રધાન ત્રીજા વખત મધ્ય પૂર્વના આ દેશમાં જઈ રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાનની મુલાકાત યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાલદ અલ નાહ્યાન સાથે થશે. જાલદે દુનિયામાં જે ઘટનાક્રમ રહ્યો છે, જેને જોતા બંને દેશ દ્વિપક્ષીય સંબંધોને નવી ધાર આપવાનો પ્રયાસ કરશે. સરકારી નિવેદનોનું માનીએ તો, બંને દેશો વચ્ચે કુટુંબીતિક ભાગીદારી, બંનેના હિતથી જોડાયેલ ક્ષેત્રીય અને ઈન્ટરનેશનલ મુદ્દાઓ પર ગહન અને વિસ્તૃત વાતચીત કરાશે. વડાપ્રધાન મોદીની મુલાકાત રાષ્ટ્રપતિ સિવાય યુએઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષા મંત્રી સાથે પણ થશે. વડાપ્રધાન દુબઈમાં વિશ્વ સરકાર શિખર સંમેલનમાં પણ ભાગ લેશે અને પછી એક ભાષણ આપશે. દુબઈ બાદ વડાપ્રધાનનો કાર્યક્રમ અબુધાબીનો છે. અહીં તે અબુધાબીના પહેલા હિન્દૂ મંદિર બાપ્સનું ઉદ્ઘાટન કરશે. અહીં તેમનો વધુ એક કાર્યક્રમ ભારતીય સમુદાયને સંબોધિત કરવાનો પણ છે. ભારત-યુએઈ સંબંધ રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક મુદ્દાઓ પર ટકેલો છે. ભારત-યુએઈની નિકટતાનો સૌથી મજબુત આધાર



અણુ ધાતી, સંયુક્ત આરબ અમીરત (યીએઈ)માં એક હોટલમાં ભારતીય ડાયરેક્ટરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

૧૫ ફેબ્રુઆરી સુધી દેશના કેટલાક ભાગમાં વરસાદની સંભાવના રહેશે

! (એજન્સી) નવી દિલ્હી, તા.૧૩ | ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે જેમાં ૧૩-૧૫ ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશામાં ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીએ, દક્ષિણ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશમાં ૧૩-૧૫ ફેબ્રુઆરીએ હળવોથી



મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડમાં કરા પડવાની શક્યતા છે. બીજા તરફ આજે દિલ્હીમાં વાદળાણું વાતાવરણ રહેશે. જો કે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

કેનેડિયન સિટિઝનશિપ માટેની અરજીઓમાં ઘટાડો

! (એજન્સી) નવી દિલ્હી, તા.૧૩ | ભણવા અને કામ કરવા માટે ભારતીયો વિદેશ જવાનો વિચાર કરે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા હોય છે. ત્યાર પછી યુકે અને કેનેડા જેવા દેશોનો વારો આવે છે. કેનેડાએ લાખો ભારતીયોમાં પાછલા કેટલાક વર્ષોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું, પરંતુ હવે ભારતીયોને ત્યાંની કડવી વાસ્તવિકતા સમજાઈ રહી છે. કેનેડા ગયા પછી અને દિવસ-રાત ભારે ઢસરડો કર્યા પછી પણ લાઈફ આસાન બની જશે તેની કોઈ ગેરંટી નથી. તેના કારણે કેનેડાના પીઆર ધરાવતા લોકો પણ કેનેડિયન સિટિઝનશિપ માટે અરજી કરવાનું ટાળે છે. તાજેતરનો ટ્રેન્ડ દર્શાવે છે કે કેનેડિયન સિટિઝનશિપ માટેની અરજીઓમાં ઘટાડો થયો છે. કેટલાક કિસ્સામાં તો કેનેડામાં સેટલ થવાના બદલે લોકો રિવર્સ માર્ગરેશન કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે પંજાબના લગભગ દરેક શહેરના રોડ પર વિઝા કન્સલ્ટન્ટની જાહેરખબરો જોવા મળે છે.

સેન્સેક્સમાં ૪૮૨ અને નિફ્ટીમાં ૧૨૭ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

અપોલો હોસ્પિટલ, સિલા, બજાજ ઓટો, રિલાયન્સ ઈન્ફર્સ્ટ્રક્ચર અને ડો. રેડ્ડીઝલેબના શેર પર સમાહની ટોચે પહોંચ્યા

! (એજન્સી) મુંબઈ, તા.૧૩ | શેરબજારનો કારોબાર મંગળવારે સારી રીતે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ ૪૮૨ પોઈન્ટના વધારા સાથે ૭૧૫૫૫ પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૨૭ પોઈન્ટના વધારા સાથે ૨૧૭૪૩ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. શેરબજારમાં મંગળવારે દિવસના કારોબારમાં તેજ રહી હતી. નિફ્ટી બેંક ઈન્ડેક્સ એક ટકાથી વધુ ઉછળી રહ્યો હતો.



આઈશર મોટર્સે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો સાથે ૨૧૭૪૩ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. શેરબજારમાં મંગળવારે દિવસના કારોબારમાં તેજ રહી હતી. નિફ્ટી બેંક ઈન્ડેક્સ એક ટકાથી વધુ ઉછળી રહ્યો હતો.

સાથે બંધ રહ્યો હતો. શેરબજારના ટોપ ગેનર્સની વાત કરીએ તો તેમાં સારી ગતિ નોંધાઈ હતી અને પાનની બેંકિંગ શેરમાં ઘણી વૃદ્ધિ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારા સાથે, નિફ્ટી મિડકેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી, નિફ્ટી બેંક, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એક્સેમસીજી અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસમાં વધારો નોંધાયો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ મામૂલી ઘટાડા સાથે બંધ રહ્યો હતો. શેરબજારના ટોપ ગેનર્સની વાત કરીએ તો તેમાં કોલ ઈન્ડિયા, યુપીએલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ અને વિપ્રોના શેરનો સમાવેશ થાય છે, જ્યારે શેરબજારના ટોપ ડ્રોડર્સમાં હિન્દાલ્કો, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દિલ્હીની લેબ્સ, બીપીસીએલ અને ટાઈટનના શેર સામેલ હતા.

રિલાયન્સની માર્કેટ કેપ ૨૦ લાખ કરોડનો આંક વટાવી ગઈ



! (એજન્સી) નવી દિલ્હી, તા.૧૩ | મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ જૂથે એક પછી એક સફળતાઓ મેળવી છે અને હવે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. રિલાયન્સની માર્કેટ કેપિટલ આજે ૨૦ લાખ કરોડને પાર કરી ગઈ છે. ભારતીય શેરબજારમાં આરઆઈએલએ પહેલી કંપની બની છે જેની બજારમૂલ્ય ૨૦ લાખ કરોડનો આંક વટાવી ગઈ છે. આજે રિલાયન્સનો શેર બીએસઈ પર ૧.૮૯ ટકા વધીને ૫૨ વીકની હાર્ટ સપાટી રૂ. ૨૮૫૭.૮૦ પર પહોંચ્યો ત્યારે તેની માર્કેટ કેપે પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. છેલ્લા બે અઠવાડિયાની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઈન્ડ.નો શેર એવો વધ્યો છે કે તેની માર્કેટ કેપિટલમાં એક લાખ કરોડનો વધારો થયો છે. ૨૯ જાન્યુઆરીએ RILની માર્કેટ કેપ ૧૯ લાખ કરોડ હતી અને આજે ૨૦ લાખ કરોડનો આંકડો પણ વટાવી દીધો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ૧ જાન્યુઆરી ૨૦૨૪થી અત્યાર સુધીમાં રિલાયન્સનો શેર ૧૪ ટકા વધ્યો છે. મુંબઈ સ્થિત રિલાયન્સ જૂથ ઓઈલથી લઈને ટેલિકોમ સુધીના બિઝનેસમાં હાજરી ધરાવે છે. તાજેતરમાં તેના બિઝનેસમાં જિયોના કારણે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ઓગસ્ટ ૨૦૦૫માં આરઆઈએલનો શેર રૂ. ૧ લાખ કરોડના માર્કેટ કેપના આંકને આંબી ગયો હતો. ત્યારે તે એક મોટી સિદ્ધિ હતી. ત્યાર પછી નવેમ્બર ૨૦૧૯માં રિલાયન્સે રૂ. ૧૦ લાખ કરોડનો સ્તર પ્રાપ્ત કર્યો હતો. ૨૦ લાખ કરોડની માર્કેટ કેપિટલ સાથે આરઆઈએલએ ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે તેની તુલનામાં ટીસીએસની માર્કેટ કેપ રૂ. ૧૫ લાખ કરોડ છે. ત્રીજા ક્રમે એચડીએફસીબેંકની માર્કેટ કેપિટલ રૂ. ૧૦.૫ લાખ કરોડ, આઈસીઆઈસીઆઈબેંકની માર્કેટ કેપ રૂ. ૭ લાખ કરોડ અને ઈન્ફોસિસની માર્કેટ કેપિટલ રૂ. ૭ લાખ કરોડ છે. એક્સપર્ટ માને છે કે વર્ષ ૨૦૨૪માં રિલાયન્સ વધુ ઉંચાઈ પ્રાપ્ત કરી શકે છે. જેફરીએ આ શેર માટે ૩૧.૪૦ રૂપિયાનો ટાર્ગેટભાવ આપ્યો છે જ્યારે રિલાયન્સે આ શેરને બાય રેટિંગ આપ્યું છે. અન્ય બ્રોકરેજ સિટીએ રિલાયન્સના શેરને ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે. સિટીએ રિલાયન્સના શેર માટે ૨૮.૧૦ રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. રિલાયન્સે ડિસેમ્બર ક્વાર્ટરના રિજલ્ટની જાહેરાત કરી જે બજારની અપેક્ષા મુજબ જ હતી. કંપનીનો ટેક્સ બાદ નફો ત્રિમાસિક ધોરણે ૧.૨ ટકા ઘટ્યો હતો જ્યારે વાર્ષિક ધોરણે તેમાં ૧૦.૩ ટકાનો વધારો થયો હતો.

તંત્રી લેખ...



૬ દેશોએ વિઝા ફ્રી ટ્રાવેલની સગવડ આપી

ભારતીયોને હવે વિદેશ પ્રવાસનો ચરકો લાગી ગયો છે. આજેનો ફાયદો લેવા માટે ઘણા દેશો ભારતીયોને વિઝા વગર એન્ટ્રી આપવાની ઓફર કરે છે. વિઝા ફ્રી એન્ટ્રીની સગવડ હોય તો ભારતીય ટુરિસ્ટોની સંખ્યા આપોઆપ વધી જાય છે. તાજેતરમાં એક પછી એક ૬ દેશોએ ભારતીયો માટે ખાસ સ્કીમની જાહેરાત કરી છે. તેથી આ દેશોની મુલાકાત લેવા માટે તમારે પહેલાં વિઝાની માથાકૂટમાં પડવાની જરૂર નથી. મલેશિયા આ વિસ્તારમાં પહેલા નંબર પર છે. મલેશિયા પહેલાંથી ટુરિસ્ટ ફ્રેન્ડલી દેશ છે જેની મુલાકાત લેવા માટે ભારતીયોને અગાઉ વિઝાની જરૂર પડતી હતી. પરંતુ હવે તેઓ ડાયરેક્ટ મલેશિયા જઈ શકે છે. ૧ ડિસેમ્બર ૨૦૨૩થી ભારતીયોને આ લાભ મળી રહ્યો છે અને હજુ પણ ચાલુ છે. તેથી મલેશિયામાં ૩૦ દિવસ સુધીના ટ્રાવેલ માટે પહેલાંથી વિઝાની જરૂર નથી. જોકે, એરપોર્ટ પર પ્રાથમિક સ્ક્રિનિંગ કરવામાં આવશે. કોઈ વ્યક્તિનો રેકોર્ડ ખરાબ હશે અથવા ત્રાસવાદની ઘટનાઓ સાથે સંકળાયેલ હશે તો તેને એન્ટ્રી નહીં મળે. આફ્રિકાના દેશ કેન્યામાં પણ ભારતીયો વગર વિઝાએ જઈ શકે છે. ૧ જાન્યુઆરીથી કેન્યાએ આ ઓફર કરી છે. કેન્યાએ આમ તો તમામ ગ્લોબલ વિઝિટર્સ માટે વિઝા ફ્રી એન્ટ્રી જાહેર કરી છે. તેનાથી કેન્યાના ટુરિઝમને ભારે પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે કારણ કે આ દેશ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીંના જંગલોમાં એવા પ્રાણીઓ જોવા મળશે જે તમને બીજે ક્યાંય નહીં દેખાય. થાઈલેન્ડ પણ ગયા વર્ષથી જ ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. આ ઓફર ૧૦ નવેમ્બર ૨૦૨૩થી શરૂ થઈ છે અને ૧૦ મે ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. આ ઓફર માત્ર ટુરિસ્ટ માટે છે અને ૩૦ દિવસ સ્ટે માટે લિમિટેડ છે. વિયેતનામમાં પણ ભારતીયો વિઝા વગર જઈ શકે છે. ભારતીયો ઉપરાંત ચીનના લોકોને પણ વિયેતનામ આ સુવિધા આપી છે. હાલમાં ચોક્કસ યુરોપિયન દેશોના લોકો જ વિયેતનામમાં વિઝા વગર જઈ શકતા હતા. અન્ય લોકોએ ૯૦ દિવસની વેલિડિટી સાથે ઈ વિઝા લેવાના હોય છે. શ્રીલંકા એ ભારતનો પડોશી દેશ છે અને કુદરતી સૌંદર્યથી છલકાય છે. શ્રીલંકાએ એક પાઈન્ટ પ્રોજેક્ટ તરીકે ભારતીયોને વિઝા વગર એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે અને આ ઓફર ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી મર્યાદિત છે. ઈરાન પણ ભારત સાથે સારી મિત્રતા ધરાવે છે અને ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. ૪ ફેબ્રુઆરીથી ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ ઈરાનમાં વિઝા વગર જઈ શકશે. તેમાં શરત માત્ર એટલી છે કે ઈરાનમાં વધુમાં વધુ ૧૫ દિવસના રોકાણની મંજૂરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસકામો પ્રજાને સમર્પિત કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મતવિસ્તારમાં બાણગંગા તળાવ, ઝોલાપુર તળાવ, AUDA ઓડિટોરિયમનું લોકાર્પણ સહિત સહકાર ભવન અને ગોડાઉનનું ભૂમિપૂજન મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન



ગાંધીનગર

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિકાસકામો પ્રજાને સમર્પિત કર્યા હતા. સાણદ તાલુકાના ગામોમાં તળાવોના લોકાર્પણ સહિત સહકાર ભવન અને ગોડાઉનનું ભૂમિપૂજન તથા અમદાવાદમાં ઈન્ડિય ઓડિટોરિયમનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયું હતું.

ડો. શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન અને ગોડાઉનનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના સાણદ ખાતે ડો. શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન અને ગોડાઉનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સહકાર ભવન અને ગોડાઉન આશરે ૨૪ કરોડના ખર્ચે સુવિધાયુક્ત બનાવવામાં આવનાર છે.

નિર્માણ થનાર સહકાર ભવન આશરે ૧૦૨૪૪.૭૭ ચો. મી. વિસ્તારમાં ફેલાયેલું હશે. આશરે ૧૬૧ જેટલી દુકાનો આ ભવનમાં બનાવાશે. ચાર માળના આધુનિક ભવનમાં તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત બિલ્ડિંગમાં રૂફ ટોપ સોલાર સિસ્ટમની પણ સુવિધા હશે. અહીં નિર્માણ પામનાર ગોડાઉન આશરે ૨૪૮૨.૭૪ ચોમી વિસ્તારમાં નિર્મિત થશે, જેના કુલ ૩ યુનિટ હશે.

શેલા ખાતે નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઓડા) દ્વારા શેલા ટી.પી સ્કીમ નં-૦૧ અને એફ.પી.નં-૧૮૬માં રૂપિયા ૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ ઓડિટોરિયમનું લોકાર્પણ કરાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ બાદ ઓડિટોરિયમમાં બેસીને ઓડાના વિકાસકાર્યોની ટૂંકી ફિલ્મ પણ નિહાળી હતી.

શેલા ખાતેના આ અત્યાધુનિક ઓડિટોરિયમનું ક્ષેત્રફળ ૯૨૬૦ ચોરસ મીટર છે, જેનો બિલ્ડઅપ એરિયા ૧૦,૬૪૨ ચોરસ મીટર છે, પાર્કિંગનું ક્ષેત્રફળ ૫૦૬૦ ચોરસ મીટર છે, ઓડિટોરિયમમાં કુલ ૧૦૫૪ લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. અહીંના બેંકવેટ હોલ કુલ ૫૦૦ લોકોની ક્ષમતા ધરાવે છે.

મોડાસર ખાતે નવીનીકરણ પામેલ બાણગંગા તળાવનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાણદના મોડાસર ખાતે ઝાંઝડસ લાઈફ સાયન્સિસ લિમિટેડ તથા ઝાંઝડસ ફાઉન્ડેશનના સહયોગથી રૂપિયા ૬૯૭ લાખના ખર્ચે નવીનીકરણ પામેલ બાણગંગા તળાવનું પણ લોકાર્પણ કરાવ્યું હતું.

સરસ્વતી પૂજા દરમિયાન વસંત પંચમીના શુભદિવસે આ સરસ્વતી સ્તુતિનો પાઠ કરવાથી તમને વિશેષ લાભ થશે

આજે સરસ્વતી-પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત પંચમી



વિશેષ
શશપાલસિંહ ટી. વાહલા
(દરબાર ગઝ, થરા)

વસંત પંચમી પંચમીના દિવસે ૩૦ વર્ષ બાદ શશ મહાપુરુષ રાજયોગની રચના થઈ રહી છે, તેથી આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે

આજે તા. ૧૪/૦૨/૨૦૨૪ને બુધવારે મહાસુદ પાંચમ એટલે સરસ્વતી પૂજા ઉત્સવ વસંત પંચમી સાથે સંત વેલેન્ટાઈન ડે પણ છે. આપણે આપણા તહેવારોને ઔપચારિક કર્યા છે અને બીજા જે વલગારી તહેવારો પાનપાન રહેણી કરણી પહેરવેશમાં અંધ બની કુદી પડ્યા છીએ ત્યારે આપણા તહેવારોનું આરોગ્ય સંસ્કાર સાથે અનોખું યોગદાન રહેવું છે એ ભૂલ્યા એટલે જ આજે શારિરીક માનસિક રીતે અસ્થિર બની બાહ્ય હવાતિયાં મારીએ છીએ. આજે સરસ્વતી સાથે પ્રકૃતિનો ઉત્સવ વસંતપંચમી છે કેસુડો એ રંગ આરોગ્યની સાથે એકમેકના મન હૃદયને હરખાવેલા કરી નામે આ ભારતીય સંસ્કૃતિની દેન છે. પરિવાર સાથે વસંતોત્સવ ઉજવો વેલેન્ટાઈન ડેની ઉજવણી જેની છે તેમને કરવા દો. તમે ખુશ એમને ખુશ જૂઓ આજે વસંત પંચમી વિશે જાણીએ. વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજબ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે જે જાન્યુઆરી મહિનાના અંતમાં કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે. ભારતીય સંસ્કૃતિમાં વાર તહેવાર વ્રત ઉપાસના આરાધના ઉજવણી ઉજાણીનું આગવું મહત્વ પ્રકૃતિક તત્વોને સાંકળીને ગોઠવવામાં આવ્યું છે. આજે સરસ્વતી પૂજા ઉત્સવ વસંત પંચમી આજે ૧૪ ફેબ્રુઆરીના રોજને મહાસુદ પાંચમને બુધવાર સરસ્વતી પૂજા ઉત્સવ

નો હિન્દુ પરંપરાઓ અને શાસ્ત્રો માં વસંત પંચમીનો ઉલ્લેખ સરસ્વતી પૂજા ઉત્સવના નામથી પણ કરવામાં આવ્યો છે. મહા મહિનાની સુદ પંચમીના રોજ ઉજવાતો આ મહત્વનો તહેવાર વસંત પંચમી અન્ય ઘણા નામોથી ઓળખાય છે. જેમાં શ્રી પંચમી, ઋષિ પંચમી, વાગીથરી જયંતિ, મદનોત્સવ અને સરસ્વતી પૂજા ઉત્સવનો સમાવેશ થાય છે. જ્ઞાન, કલા અને સંગીતની દેવી માતા સરસ્વતીની આજે બુધવાર વસંત પંચમીના રોજ પૂજા કરવામાં આવશે. મા સરસ્વતીને જ્ઞાન અને શાણપણ પ્રદાતા કહેવામાં આવે છે. જ્યારે તેમના જન્મ સમયે તેમના હાથમાં વીણા હતી. આ કારણે તેને સંગીતની દેવી પણ કહેવામાં આવે છે. આ વાતનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. વસંત પંચમી પંચમીનો તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુકલ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થયા હતા. તેથી જેઓ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે, તેઓ જ્ઞાન અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે. આ દિવસે બાળકોના ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઋગ્વેદમાં લખ્યું છે કે “પ્રાણો દેવી સરસ્વતી વજેર્ભિર્વ જિનિવતિ ધીનામશ્નિત્રયવતુ.” એટલે કે તે પરમ ચેતના છે. સરસ્વતીના રૂપમાં તે આપણી બુદ્ધિ, શાણપણ અને વલણની રક્ષક છે. આજે સરસ્વતી પૂજા ક્યારે છે: વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા અથવા પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક છે. જે સરસ્વતી સ્તોત્રમનો એક ભાગ છે સરસ્વતી પૂજા દરમિયાન વસંત પંચમીના શુભદિવસે આ સરસ્વતી સ્તુતિનો પાઠ કરવાથી તમને વિશેષ લાભ થશે. આ દિવસે સરસ્વતીની પૂજા કરવાની વિધિ માતા સરસ્વતીના

ઉપાસકો એ વસંત પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. તેલમાં ચણાનો લોટ નાખીને શરીર પર માલિશ કરીને સ્નાન કરવું જોઈએ. આ પછી, તમારે પીળા વસ્ત્રો પહેરીને માતા સરસ્વતીની પૂજાની તૈયારી કરવી જોઈએ, આ પછી પૂજા સ્થાન પર શ્રેષ્ઠ વેદીના કપડાને બિછાવીને, તેના પર ચોખાથી અષ્ટદળ બનાવો. આની સામે તમે ભગવાન ગણેશ ની પ્રતિમા સ્થાપિત કરી શકો છો. અષ્ટદળની પાછળની બાજુએ જવ અને ઘઉંની બુટ્ટીની પૂંજ સાથે પાણીથી ભરેલા કલશ ની સ્થાપના કરો. વસંત પંચમીમાં સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવાની વિધિ છે. વસંત પૂંજથી રતિ અને કામદેવની પૂજા કરો અને હવન કરો. હવન કર્યા પછી, કેસર અથવા હળદરના મિશ્રણનો અર્પણ કરો. આ દિવસે, સૌ પ્રથમ અષ્ટદળ પર માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરો, ત્યારબાદ પીળા કપડાથી હળદર, ચંદન, રોલી, પીળી મીઠાઈ અર્પણ કરો. પીળા ફૂલ, અક્ષત અને કેસરી આ સિવાય વસંત પંચમીના દિવસે સંગીતનાં સાધનો અને પુસ્તકોની પૂજા કરવી જોઈએ, તેનાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તે વસંત પંચમીની શુભ તિથિ હતી. એટલે જ તેને દેવી સરસ્વતીના પ્રાગટ્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમના હાથમાં પુસ્તક અને વીણા હોવાને કારણે તેને જ્ઞાન અને સંગીતની દેવી કહેવામાં આવે છે. સૌ વાયક ચાહક શુભેચ્છક મિત્રોને વસંત પંચમી સાથે સંત વેલેન્ટાઈન ડેની હાર્દિક શુભેચ્છા. આગામી સમયમાં બોર્ડ યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજાશે ત્યારે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ વસંત પંચમી સરસ્વતીની પુજા અર્ચના કરી આશીર્વાદ મેળવી સારી સિધ્ધિ પ્રાપ્ત કરી પરિવાર સમાજનું ગૌરવ વધારો તેવી શુભેચ્છા સહ અસ્તુ.

આ પ્રકારના સંબંધથી કેટલાક લોકોને ખાસ ખુશી મળે છે...

એક્સ્ટ્રા મૈરિટલ અફેયરથી કેટલાક લોકોને ખુશી

એક્સ્ટ્રા મૈરિટલ અફેયર અથવા તો લગ્ન થયા હોવા છતાં બહાર પણ સંબંધ રાખે છે, અમારામાંથી મોટા ભાગના લોકો સ્પષ્ટપણે માને છે કે કોઈ રિલેશનશીપમાં બેવફાઈ માટે એક્સ્ટ્રા મૈરિટલ અફેયર અથવા તો લગ્ન થયા હોવા છતાં બહાર પણ સંબંધ રાખે છે. આ પ્રકારના સંબંધને તેઓ પોતાની ખુશી તરીકે પણ ગણે છે. અમેરિકાની મિસોરી સ્ટેટ યુનિવર્સિટીમાં હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબના તારણ સપાટી પર આવ્યા છે.

અમારામાંથી મોટા ભાગના લોકો નક્કરપણે અને સ્પષ્ટપણે માને છે કે કોઈ રિલેશનશીપમાં બેવફાઈ માટે કોઈ જગ્યા નથી. બે લોકોની વચ્ચે કોઈ ત્રીજાની કોઈ શક્યતા હોતી નથી. પરંતુ હાલમાં કરવામાં આવેલા સર્વેમાં કેટલીક અન્ય રોચક બાબત સપાટી પર આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે કેટલાક દંપતિ એવા પણ છે જે એક્સ્ટ્રા મૈરિટલ અફેયર અથવા તો લગ્ન થયા હોવા છતાં બહાર પણ સંબંધ રાખે છે. આ પ્રકારના સંબંધને તેઓ પોતાની ખુશી તરીકે પણ ગણે છે. અમેરિકાની મિસોરી સ્ટેટ યુનિવર્સિટીમાં હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબના તારણ સપાટી પર આવ્યા છે.



આગળ વધી રહી છે. આંકડાના કહેવા મુજબ પુરૂષો કરતા મહિલાઓ વધારે પોતાના લગ્ન સિવાયના સંબંધોના કારણે વધારે સંતુષ્ટ દેખાઈ છે. આ સંતુષ્ટી માટેના કેટલાક કારણ જવાબદાર રહ્યા છે. જેમ કે ગુડસથીમાં પાર્ટનર સાથે સેક્સ સંબંધ રાખવાની બાબતમાં સંતોષ ન મળવાની બાબત પણ સામેલ છે. બહારના પાર્ટનર સાથે સેક્સ સંબંધ રાખવાની સ્થિતિમાં સંતોષ મળે છે. આ આઉટસાઈટ પાર્ટનરની સાથે સમાહમાં બે વખત સેક્સ સંબંધો બનાવવા માટેની બાબત સામેલ છે. એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે આ પ્રકારના લગ્ન બાદના સંબંધો ખતમ થઈ જાય છે ત્યાર પાર્ટનરની સાથે વિશ્વાસઘાત કરવાનો કોઈ અનુભવ થાય છે કે કેમ તેને લઈને પણ પ્રશ્નો સર્વેના ભાગરૂપે પુછવામાં આવ્યા હતા. ઈરાન કરનાર બાબત તો એ છે કે શોધમાં સામેલ કરવામાં આવેલા મોટા ભાગના લોકોએ કહ્યું છે કે લગ્નના સંબંધનો અંત આવ્યા બાદ તો જીવનમાં પહેલા કરતા

વધારે ખુશી મળે છે. માત્ર આ જ સર્વેમા સંબંધ અને બેવફાઈ વચ્ચેના સંબંધ જોડવામાં આવ્યા નથી. એક જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો પોતાના લગ્ન સિવાય બહારના સંબંધ રાખે છે અને તેની માહિતી પાર્ટનરને આપતા નથી તે લોકો વધારે ખુશ રહે છે. આપણે બધા જાણીએ છીએ કે લગ્નતર સંબંધ એટલે લગ્ન પછી સ્ત્રી કે પુરુષ સિવાયની વ્યક્તિ સાથે બંધાતો સંબંધ, પરંતુ શું તમે જાણો છો કે આના ૮ પ્રકાર છે. દરેક બાબત પાછળ કોઈને કોઈ અર્થ અને હેતુ હોય છે. આ બાબત વાસ્તવિકતા છે કે આ સર્વેના પરિણામ દર્શાવે છે કે જે લોકોએ પોતાના ગહસ્થીની બહાર સંબંધ બનાવ્યા છે તે ખુશ દેખાયા છે પરંતુ આનો અર્થ એ નથી કે પરિણિત લાઈફમાં રહેલી સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ સમસ્યાનો ઉકેલ છે. તમામ જાણકાર લોકો કહે છે કે થોડાક સમયની ખુશી કેટલાક પરિવારને બરબાદ કરી નાંખે છે. પોતાના પાર્ટનરની સાથે વિશ્વાસઘાત કરીને હોંસલ કરવામાં આવેલી ખુશી થોડાક સમય માટેની હોય છે. સાથે સાથો જોખમી હોય છે. આના કારણે અનેક લોકોની લાઈફ ખોરવાઈ જવાનો ખતરો રહે છે. પારસ્પરિક સમસ્યાનો ઉકેલ વાસ્તવિક મારફતે જ આવી શકે છે. વાસ્તવિક મારફતે અને સંતોષની લાઈફ મારફતે પરિણિત જીવનને વધારે સાનુકુળ બનાવી શકાય છે. પરિણિત લાઈફમાં ખુશી લાવવા માટે વિશ્વાસ સૌથી ઉપયોગી બાબત છે એવા પછો સમાચાર મળી ચુક્યા છે કે આજના દોરમાં મોટા ભાગે લોકો લગ્ન બહારના સંબંધ રાખવા માટે ઈચ્છુક બન્યા છે.

પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણની તૈયારીના ફોટો પણ જારી ન થયા

પાકિસ્તાન પાસે ખરેખર પરમાણુ બૉમ છે?

અનેક પ્રકારની બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો કહી શકાય છે કે પાકિસ્તાન વિતેલા વર્ષોમાં પરમાણુ પરીક્ષણનું નાટક કર્યું હતું, પાકિસ્તાન એક પરમાણુ શક્તિ દેશ છે

ભારત દ્વારા જ્યારે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પ પર હુમલા કરવામાં આવ્યા ત્યારે પાકિસ્તાને કેટલાક દિવસ સુધી નિવેદનો કરવામાં આવ્યા હતા કે પાકિસ્તાન એક પરમાણુ શક્તિ દેશ છે. પાકિસ્તાને તેના પરમાણુ બૉમ ડ્રાઈંગ રૂમમાં સજ્જવા માટે તૈયાર કર્યા નથી. ભારતની સામે પરમાણુ બૉમનો ઉપયોગ કરવામાં આવી શકે છે તેવા નિવેદન પણ કેટલાક કક્કરપંથીઓ દ્વારા આડેડડ નિવેદન પણ કર્યા હતા. જો કે પાકિસ્તાનની હવા છેલ્લે નિકળી ગઈ હતી. જો કે પાકિસ્તાનની આ તમામ બાબતો આખરે પોકળ સાબિત થઈ હતી. જો કે તમામ લોકોને આશ્ચર્ય થશે કે બાલાકોટમાં ત્રાસવાદી અક્ષરોને ફુંકી મારવામાં આવ્યા બાદ પણ પાકિસ્તાને કોઈ પગલા લેવાની હિંમત કરી નથી. આ એવા પ્રકારની ઘટના બની છે જેના કારણે હવે શંકા વિશ્વાસમાં ફેરવાઈ જાય છે. એવી શંકા થવા લાગી છે કે આખરે પાકિસ્તાનની પાસે એવી તો કઈ જાદુઈ છંદી આવી ગઈ છે કે વર્ષ ૧૯૭૨ના પરમાણુ પોખરણ -૧ના ચાર વર્ષના ગાળા બાદ પાકિસ્તાનમાં પરમાણુ એન્જિનિયરો ઉભા થઈ ગયા હતા. વર્ષ ૧૯૭૬માં પાકિસ્તાન એટોમિક એનર્જી કમીશનની રચના પણ કરી લેવામાં આવી હતી. તેના પરમાણુ કાર્યક્રમની આટલી વહેલી તકે શરૂઆત પણ થઈ ગઈ હતી. પાકિસ્તાને પરમાણુ કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ તેની પ્રગતિને લઈને કોઈ રિપોર્ટ જારી કરવામાં આવ્યા નથી. તેની કોઈ માહિતી વર્ષ ૧૯૯૮ સુધી જારી કરવામાં આવી ન હતી. અમેરિકાની ટોપની જાસુસી સંસ્થાઓ સીઈએ, એફબીઆઈ અને પેન્ટાગોન સહિતની સંસ્થાઓ દ્વારા કોઈ માહિતી પાકિસ્તાનના



પરમાણુ કાર્યક્રમ અંગે આપવામાં આવી નથી. સામાન્ય રીતે જોવામાં આવે છે કે જ્યારે પણ ભારત પર કોઈ ત્રાસવાદી હુમલો થાય છે ત્યારે પાકિસ્તાન તરફથી હુમલામાં તેની કોઈ સંડોવણી નથી તેવી વાત કરવામાં આવે છે. સાથે સાથે કહેવામાં આવે છે કે જો લડાઈ છંડાઈ જાય તો પાકિસ્તાન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. સાથે સાથે જંગી નુકસાન થઈ શકે છે. પોખરણ-૨ પરીક્ષણ ૧૧ અને ૧૩મી મે ૧૯૯૮ના દિવસે કરવામાં આવ્યા હતા. જેના માટે ભારતના મહાન વૈજ્ઞાનિકો વર્ષો સુધી લાગેલા હતા. સમય સમય પર બીએઆરસીની પ્રગતિ અને સિદ્ધીઓ અંગે હેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આજે પણ મિડિયા મારફતે માહિતી આવતી રહે છે. પરંતુ પાકિસ્તાનના સંદર્ભમાં ક્યારેય કોઈ માહિતી જારી કરવામાં આવતી નથી. દાખલા તરીકે જોવામાં આવે તો વર્ષ ૧૯૯૫માં બેનેઝીર ભુટ્ટોએ કહ્યું હતું કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ ૧૯૭૧ના પહેલા શાંતિ માટે હતો. છતાં પણ આશ્ચર્યજનક રીતે જાદુની છંદીથી માત્ર ૧૫ દિવસના ગાળામાં જ ૨૮ અને ૩૦મી મે વર્ષ ૧૯૯૮ના દિવસે પાકિસ્તાન દ્વારા પરમાણુ પરીક્ષણ કરી લેવામાં આવે છે. ધ્યાન આપવા

જેવી બાબત એ છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચશમા શહેરમાં કહુટા ખાતે ચીનના સહકાર સાથે પરમાણુ પાવર પ્લાન્ટ બનાવી દીધો હતો. આટલામાં પાકિસ્તાનના તમામ ખેલને સારી રીતે સમજી શકાય છે. વાસ્તવિકતા એ છે કે જ્યાં પણ માહિતી હોઈ શકે છે ત્યાં તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણ વેળા બૉમમાં આખરે કઈ ચીજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં યુરેનિયમ હતું થોરિયમ હતું. પ્લુટોનિયમ જથ્થો હતો કે પછી અન્ય કોઈ રસાયણ હતા. પાકિસ્તાને કેટલીક વખત કહ્યું હતું કે તેના દ્વારા પ્લુટોનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે શક્ય દેખાતુ નથી. ઉપલબ્ધ સુચના મુજબ તો આ બાબત પણ સ્પષ્ટ નથી કે તેમનું પરીક્ષણ ફ્યુઝન છે કે પછી ફિશન છે. આમાંથી એક પરમાણુ બૉમ છે અન્ય હાઈડ્રોજન બૉમ છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે બલુચિસ્તાનના રેરા ગાજી ખાનમાં સ્થાનિક પિચબ્લેન્ડ મારફતે ૧૦૦૦૦ પાઉન્ડ યુરેનિયમનું ઉત્પાદન કરે છે. મજાની વાત એ છે કે સમગ્ર દુનિયામાં માત્ર ત્રણ દેશ ક્ષત્રિકિસ્તાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા મળીને માત્ર ૧૦૦૦ ટન પ્રતિવર્ષ ઉત્પાદન કરે છે. સાથે સાથે દુનિયાને વેચે છે. જેથી પાકિસ્તાનના તમામ દાવાને લઈને હજુ પણ પ્રશ્ન થાય છે. પાકિસ્તાન પાસે પરમાણુ બૉમ છે કે કેમ તેને લઈને સતત પ્રશ્ન થાય છે. કારણ કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને લઈને પુરાવા મળ્યા નથી. પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમની વિગત મેળવી લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી ગયા હોવા છતાં વિગત મળી શકી નથી. જેથી કેટલા નિષ્ણાંત તો પાકિસ્તાનના પરમાણુ બૉમના દાવાને નાટક ગણે છે.

જ્યારે એવું લાગે કે તમારું કામ પૂરવું સારું નથી ત્યારે શું કરવું જોઈએ?



શું સફળતા માટે આત્મ-શંકા અને નિર્ણય જરૂરી છે? શું તમારે વધુ સારું બનવાની ડ્રાઈવ શોધવા માટે તમારા કામથી નાપુશ હોવું જરૂરી છે? શું આપણી જાતને ન્યાય આપવાથી આપણને વધુ સારું બને છે? મને નથી લાગતું કે તે કરે છે. ઈરાદાપૂર્વકની પ્રેક્ટિસ તમને વધુ સારી બનાવે છે. તમારા રેસમાં મૂકવું એ તમને વધુ સારું બનાવે છે. કંટાળાને પ્રેમમાં પડવું એ તમને વધુ સારું બનાવે છે. અલબત્ત, તે કાર્યો પૂર્ણ કરતાં વધુ સરળ છે. જ્યારે હું મારી જાતને મારા કામનો નિર્ણય કરવાની જાળમાં ફસાતો જોઉં છું, ત્યારે હું મારી જાતને પાટા પર પાછા ખેંચવા માટે અહીં એક વ્યૂહરચનાનો ઉપયોગ કરું છું: હું યાદ રાખવાનો પ્રયત્ન કરું છું કે દરેક પરિણામ પુનરાવર્તનના સ્પેક્ટ્રમ સાથે માત્ર એક બિંદુ છે. તમે પ્રાપ્ત કરી શકો તે દરેક પરિણામ એ પુનરાવર્તન અને સમયના સ્પેક્ટ્રમ સાથેનો એક બિંદુ છે. ચોક્કસ ધ્યેય માટે તમારે કેટલા પુનરાવર્તનોની જરૂર છે તે તમારા સંજોગો, તમારા અનુભવો, તમારી તાલીમ અને અન્ય ઘણા પરિબલો પર આધારિત છે. દરેક વ્યક્તિનું પુનરાવર્તનનું સ્પેક્ટ્રમ અનન્ય છે: તમારું સ્પેક્ટ્રમ મારા કરતા અલગ છે. એ સમજવું અગત્યનું છે કે તમે પોઈન્ટ છ પર છો અને અન્ય કોઈ પોઈન્ટ ઝ પર છો તેનો અર્થ એ નથી કે તમે બરાબ કામ કરી રહ્યા છો. વાસ્તવમાં કોઈ બરાબ કામ કે સારું કામ હોતું નથી. જેમ ગુલાબના બીજ જેવી કોઈ વસ્તુ બરાબ ગુલાબની ઝાડી નથી. સમય અને પુનરાવર્તનમાં માત્ર બિંદુઓ છે. તમારી જાતને સારી કે બરાબ તરીકે વ્યાખ્યાયિત કરવાની ઈચ્છા છોડો. કોઈપણ વ્યક્તિગત પરિણામ સાથે જોડાણ છોડો. જો તમે હજી સુધી કોઈ ચોક્કસ મુદ્દા પર પહોંચ્યા નથી, તો તેના કારણે તમારી જાતને જજ કરવાની જરૂર નથી. તમે સમયને વધુ ઝડપી બનાવી શકતા નથી અને તમે આજ પહેલાં જે પુનરાવર્તનો કર્યાં છે તેની સંખ્યા બદલી શકતા નથી. એકમાત્ર વસ્તુ જે તમે નિયંત્રિત કરી શકો છો તે આગામી પુનરાવર્તન છે. લેખન: આ કિસ્સામાં, પુનરાવર્તનો "પ્રકાશિત લેખોની સંખ્યા" હોઈ શકે છે. આંતરિન્યોરશિપ: આ કિસ્સામાં, પુનરાવર્તનો "વ્યવસાયમાં વર્ષો" અથવા "સેલ્સ કોલ્સની સંખ્યા" હોઈ શકે છે.

આરામ અનુભવવા માટે નિયમિતપણે ૮ અથવા ૯ કલાકથી વધુની ઊંઘની જરૂર હોય છે ઉંમર પ્રમાણે તમારે કેટલી ઊંઘ જરૂરી છે?

વધતી ઉંમરને કારણે તમારી ઊંઘમાં ઘણા કલાકો સુધી ફેરફાર ન થવો જોઈએ, જો આ કોઈની સાથે ફેરફાર થઈ રહ્યું છે, તો સ્વાસ્થ્ય તપાસ કરાવવી જોઈએ

લોકો ઉંમરની સાથે વધુ ઊંઘવા લાગે છે અને માને છે કે આ વૃદ્ધત્વની સામાન્ય નિશાની છે

લોકોએ સ્વસ્થ રહેવા માટે દરરોજ ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ. આનાથી ઓછી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખતરનાક છે, પરંતુ આનાથી વધુ ઊંઘ લેવાથી ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આ સાંભળીને તમે ચોકી જશો, પરંતુ આ બિલકુલ સત્ય છે. દરરોજ ૧૨-૧૪ કલાકની ઊંઘ તમને અનેક રોગોના દર્દી બનાવી શકે છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, લોકોએ ફિટ અને સ્વસ્થ રહેવા માટે દરરોજ પૂરતી ઊંઘ લેવી જોઈએ. ઊંઘનો અભાવ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. નિષ્ણાતોના મતે પુષ્ટ વયના લોકો માટે દરરોજ ૭ થી ૮ કલાકની ઊંઘ જરૂરી માનવામાં આવે છે. જો કે, કેટલાક લોકો સંપૂર્ણ ઊંઘ મેળવવા માટે દરરોજ ૧૦-૧૧ કલાક સૂતા હોય છે. તેઓ વિચારે છે કે, તેઓ જેટલી વધુ ઊંઘને તેટલો તેમના સ્વાસ્થ્યને ફાયદો થશે, પરંતુ એવું નથી. વધુ પડતી ઊંઘ શરીર માટે હાનિકારક હોઈ શકે છે અને આમ કરવાથી ડાયાબિટીસ, હૃદયરોગ સહિત અનેક ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. ઘણા સંશોધનોમાં પણ આ વાત સામે આવી છે. જો કોઈ પુષ્ટ વ્યક્તિ લાંબા સમય સુધી દરરોજ ૮ કલાકથી વધુ ઊંઘે છે, તો તેને ઓવર સ્લીપિંગ માનવામાં આવે છે. વધુ પડતી ઊંઘ લેવાથી બીમારીઓ પણ થઈ શકે છે. વધુ પડતી ઊંઘથી ટાઈપ ૨ ડાયાબિટીસ, હૃદયરોગ, સ્પૂળતા, ડિપ્રેશન, માથાનો દુખાવો સહિત અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. જો તમને

આખો દિવસ ઊંઘ આવતી રહે છે અને રાત્રે પણ વધુ પડતી ઊંઘ આવે છે, તો તે કોઈ બીમારીની નિશાની હોઈ શકે છે. ૦-૩ મહિનાના બાળકો માટે ૧૪ થી ૧૭ કલાકની ઊંઘ જરૂરી છે. ૪-૧૨ મહિનાના બાળકોને દરરોજ ૧૨ થી ૧૫ કલાકની ઊંઘની જરૂર પડે છે. ૧-૨ વર્ષના બાળકો માટે ૧૧ થી ૧૪ કલાકની ઊંઘ જરૂરી છે. ૩-૫ વર્ષના બાળકોએ દરરોજ ૧૦ થી ૧૩ કલાકની ઊંઘ લેવી જોઈએ. ૬-૧૨ વર્ષના બાળકોએ દરરોજ ૯ થી ૧૨ કલાકની ઊંઘ લેવી જોઈએ. ૧૩-૧૭ વર્ષની વયના લોકોએ દરરોજ ૮ થી ૧૦ કલાકની ઊંઘ લેવી જોઈએ. ૧૮-૨૪ વર્ષની વયના લોકો માટે દરરોજ ૭ થી ૮ કલાકની ઊંઘ જરૂરી છે. ૨૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોએ પણ ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ. જો કે, દરેક પુષ્ટ વયના લોકોએ દરરોજ રાત્રે સરેરાશ ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ. જો તમને આરામ અનુભવવા માટે નિયમિતપણે ૮ અથવા ૯ કલાકથી વધુની ઊંઘની જરૂર હોય, તો તે તબીબી સ્થિતિની નિશાની હોઈ શકે છે.



જ્યારે બધું ખોટું થાય ત્યારે કેવી રીતે ખુશ રહેવું ઉદાહરણ દ્વારા સમજાવે

અત્યંત અનિવાર્ય પરિસ્થિતિઓ ઘણીવાર આપણા મગજમાંથી પ્રતિભાવ આપે છે જે હકારાત્મકતા અને આનંદમાં વધારો કરે છે. ઉદાહરણ તરીકે, કલ્પના કરો કે તમારું ઘર ધરતીકંપમાં નાશ પામ્યું છે અથવા તમને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે અને તમારા પગનો ઉપયોગ ગુમાવવો પડશે. જ્યારે આવી ઘટનાની અસરનું વર્ણન કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે મોટાભાગના લોકો તે કેટલી વિનાશક હશે તે વિશે વાત કરે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે તેઓ ફરી ક્યારેય ચાલવા સક્ષમ ન હોવાને બદલે મૃત્યુ મળશે. પરંતુ સંશોધકોએ જે ચોથી કાઢ્યું છે તે એ છે કે જ્યારે લોકો વાસ્તવમાં ધરતીકંપ માં જીવવા અથવા પેરાવેજિક બનવા જેવી આઘાતજનક ઘટનાનો ભોગ બને છે ત્યારે તેમની ખુશીનું સ્તર ઘટનાના છ મહિના પછી લગભગ સમાન હોય છે જે ઘટનાના આગલા દિવસે હતું. આપણી મનોવૈજ્ઞાનિક રોગપ્રતિકારક શક્તિ અનિવાર્ય પરિસ્થિતિમાંથી સકારાત્મક દૈનિકોષ અને ખુશી પહોંચાડવાની આપણા મગજની ક્ષમતાને પ્રોત્સાહન આપે છે. જ્યારે આપણે આવી ઘટનાની કલ્પના કરીએ છીએ ત્યારે આપણે જે અપેક્ષા રાખીએ છીએ તેનાથી આ વિપરીત છે. "લોકો એ હકીકતથી વાકેફ નથી કે તેમના સંરક્ષણ હળવા વેદનાને બદલે તીવ્ર દ્વારા ઉત્તેજિત થવાની શક્યતા વધુ છે. આમ, તેઓ વિવિધ કદના કમનસીબીઓ પ્રત્યેની પોતાની ભાવનાત્મક પ્રતિક્રિયાઓની ખોટી આગાહી કરે છે. આ અસર અત્યંત હકારાત્મક ઘટનાઓ માટે સમાન રીતે કામ કરે છે. ઉદાહરણ તરીકે, લોટરી જીતવાથી કેવું લાગશે તે ધ્યાનમાં લો. ઘણા લોકો માને છે કે લોટરી જીતવાથી તરત જ લાંબા સમય સુધી સુખ મળશે, પરંતુ સંશોધનમાં તેનાથી વિપરીત જણવા મળ્યું છે. એક ખૂબ જ પ્રખ્યાત અભ્યાસમાં એવું જણવા મળ્યું હતું કે પેરાવેજિક્સ અને લોટરી વિજેતાઓનું સુખ સ્તર ઘટના બન્યા પછી એક વર્ષમાં આવશ્યકપણે સમાન હતું. તમે તે બરાબર વાંચ્યું. એક વ્યક્તિએ જીવન બદલી નાખતી રકમ જીતી અને બીજી વ્યક્તિએ તેમના અંગોનો ઉપયોગ ગુમાવ્યો અને એક વર્ષમાં બંને લોકો સમાન રીતે ખુશ થયા.

તમારે પછીથી સફળ થવું હોય તો અત્યારે નાપુશ થવું પડશે?

આપણામાંના મોટા ભાગના, અમુક સમયે અથવા બીજા સમયે, વિચારે છે કે જ્યારે આપણે કોઈ ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે ખુશ થઈશું. હું પછી ખુશ થઈશ... કોલેજમાંથી સ્નાતક, એક મિલિયન ડોલર બનાવો. લગ્ન કરી લે, ઘણા પૈસા ગુમાવો, નોકરી મેળવો, સ્પષ્ટ થવા માટે, હું પણ આ માટે દોષિત છું. ઘણી વખત એવું બન્યું છે કે મેં ધાર્યું છે કે હું ચેમ્પિયનશિપ જીત્યા પછી અથવા મેં સફળ બિઝનેસ બનાવ્યા પછી અથવા ઠરૂઠ ગોલ કર્યા પછી સંતોષ અને સફળતા મળશે. સમાજ આપણને કહે છે કે આ સારી વાત છે. અમે એક્સટ્રેસ વિશે સાંભળીએ છીએ જે ટોચ પર ન પહોંચે ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ થતા નથી. અમે એવા ઉદ્યોગસાહસિકો વિશે સાંભળીએ છીએ જેમણે વિચારે બદલી નાખનાર વ્યવસાય બનાવવા માટે ઉત્ખતની જેમ કામ કર્યું. મૂળ વિચાર એ છે કે ચલાવવા માટે, તમારે અસંતુષ્ટ પણ હોવું જોઈએ. બીજા સ્થાનથી અસંતુષ્ટ. સરેરાશથી અસંતુષ્ટ. પછી તમારી પાસે સમીકરણની બીજી

બાજુ છે: એવા લોકો કે જેઓ જીવન જેવું છે તેનાથી ખુશ છે. તેઓ કહે છે કે તમારે "વધુ ઈચ્છતા નથી" ની કુશળતા વિકસાવવાની જરૂર છે. કે તમે અત્યારે જ્યાં છો ત્યાં ખુશ રહી શકો. કે તમે પહેલેથી જ સંપૂર્ણ છો. ધારી શું? આ જવાબ હવે સરળ છે. જો તમે જે કરો છો તેની પ્રેક્ટિસ તમને ગમે છે, જો તમે રોજિંદા કામને પ્રેમ કરો છો, તો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરતા પહેલા અને પછી ખુશ રહી શકો છો. જ્યારે તમે જે કરી રહ્યા છો તેની પ્રક્રિયાને પ્રેમ કરવાનું શીખો અને ધ્યેય પર એટલું ધ્યાન કેન્દ્રિત ન કરો, ત્યારે તમે પ્રેરિત રહીને આપમેળે સુખ મેળવશો. જો તમે વર્કઆઉટ કરવાની પ્રેક્ટિસને પસંદ કરવાનું શીખો છો, તો તમે હમણાં જ ખુશ થશો અને તમને પછીથી પરિણામ જોવા મળશે. જો તમે તમારા વ્યવસાયનું માર્કેટિંગ કરવાની પ્રેક્ટિસને પસંદ કરવાનું શીખો છો, તો પછી તમે હમણાં જ ખુશ થશો અને તમે પરિણામો પછીથી જોશો.



BOLLYWOOD NEWS FLASH



અરશદ અને મારિયાના લગ્નને ૨૫ વર્ષ થયા

અરશદએ લગ્નના ૨૫ વર્ષ બાદ લગ્નની નોંધણી કરાવી

અરશદ વારસી પોતાની પર્સનલ લાઈફ વિશે ખુબ જ ઓછી વાત કરે છે. આ વર્ષે તેના લગ્નને ૨૫ વર્ષ પુરા થવાના છે. આ તકે અરશદ વારસીએ પોતાની પત્નીને વેલેન્ટાઈન ૩ પર ખાસ ગિફ્ટ આપી છે. તેમણે લગ્નના આટલા વર્ષો બાદ પોતાના લગ્નને રજીસ્ટર્ડ કરાવ્યા છે. મુન્નાભાઈ એમબીબીએસ, ધમાલ, ગોલમાલ જેવી ફિલ્મોમાં જોવા મળેલા અરશદ વારસીએ વર્ષ ૧૯૯૯માં મારિયા ગોરેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે લગ્નના ૨૫ વર્ષ પૂર્ણ થશે. વેલેન્ટાઈન પર કપલે એક-બીજાને સ્પેશિયલ ગિફ્ટ આપશે. હાલમાં એક ઈન્ટરવ્યુમાં અરશદ વારસીએ કહ્યું કે, ૨૫ વર્ષ સુધી લગ્નને રજીસ્ટર્ડ કરાવ્યા ન હતા. અરશદ વારસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પોતાના લગ્નની તારીખથી નક્કર છે.

વિદ્યા બાલન ફિલ્મ ભૂલ ભૂલેયાના ત્રીજા ભાગમાં પાછી નજરે પડશે

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતી વખતે કાર્તિકે માહિતી આપી હતી કે, વિદ્યા બાલન ભૂલ ભૂલેયા ૩માં ભૂલ ભૂલેયા ૩માં પાછી નજરે પડશે

કાર્તિક આર્યન ફરી એકવાર આવતી દિવાળી ૨૦૨૪ પર 'રુહ બાબા'ના નવા અવતારમાં જોવા મળશે. આ મુવીની મંજૂલિકા એટલે કે વિદ્યા બાલન પણ ભૂલ ભૂલેયા ૩માં પાછી નજરે પડશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતી વખતે કાર્તિકે માહિતી આપી હતી કે, વિદ્યા બાલન પાછી ફરી રહી છે. જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી ફેન્સ સોશિયલ મીડિયા પર ઉત્સાહિત છે. વર્ષ ૨૦૦૭માં જ્યારે 'ભૂલ ભૂલેયા' રીલિઝ થઈ ત્યારે લોકોએ તેમાં વિદ્યાને ખૂબ પસંદ કરી હતી. જો કે ૨૦૨૨માં રિલીઝ થયેલી 'ભૂલ ભૂલેયા ૨'માંથી વિદ્યા ફિલ્મમાં જોવા મળી નહોતી. પરંતુ શું તમને ખબર નહીં હોય કે આવું કેમ થયું? હવે જવાબ મળી ગયો છે કે વિદ્યા બાલન 'ભૂલ ભૂલેયા ૨'નો ભાગ કેમ ન હતી. ફિલ્મના નિર્દેશક અનીસ બઝમીએ એકવાર આ વિશે જણાવ્યું હતું. અહીંયા નોંધનીય વાત એ છે કે

અક્ષય કુમાર પણ 'ભૂલ ભૂલેયા ૨'માં જોવા મળ્યો નહોતો. તેની જગ્યાએ કાર્તિકે જોવા મળ્યો હતો. તેથી જ્યારે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તે ઈવેન્ટમાં તેના વિશે વાત કરતી વખતે અનીસ બઝમીએ કહ્યું હતું કે, અક્ષય અને વિદ્યા સ્ક્રિપ્ટ અનુસાર ફિટ નહોતા બેસતા. જો કે 'ભૂલ ભૂલેયા ૨'માં લોકોએ કાર્તિકે આર્યનને ખૂબ પસંદ કર્યો હતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર ખૂબ સારી એવી કમાણી કરી હતી. રિપોર્ટ અનુસાર તેનું બજેટ લગભગ ૮૦ કરોડ રૂપિયા હતું અને તેણે વિશ્વભરમાં ૨૬૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ મુવી બોક્સ ઓફિસ પર એકદમ હટકે સાબિત થઈ હતી. તેની સફળતા પછી બધા ફિલ્મનો ત્રીજો ભાગ આવે તેની રાહ જોઈ રહ્યા છે. આ રાહ આવતી દિવાળી ૨૦૨૪ પર પૂર્ણ થવા જઈ રહ્યાં છે.

સલમાન અને સૂરજ ફરી સાથે કામ કરશે

સલમાને તેની ડેબ્યૂ ફિલ્મ મૈને પ્યાર કિયામાં સાથે કામ કર્યું, સાથે કરેલી ૪ ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી

સલમાન ખાન જલ્દી જ પોતાના ફેન્સને કેટલાક સારા જ સૂરજ બઝજાત્યા દ્વારા નિર્દેશિત મેગા બજેટ અને મોટા પાયાની ફિલ્મમાં જોવા મળશે. સલમાન માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ બની રહી છે, કારણ કે સૂરજ બઝજાત્યાની દરેક ફિલ્મ જેમાં સલમાને કામ કર્યું છે તે સુપરહિટ રહી છે. હાલના એક રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં બે વર્ષ લાગી શકે છે કારણ કે તે હાલમાં અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મની નજીકના એક સૂરને ટાંકીને લખવામાં આવ્યું છે કે સૂરજ બઝજાત્યા અને સલમાન ખાને ફિલ્મની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ એક મોટા વિઝન સાથેની ફિલ્મ છે જે મોટા પાયે બનાવવા જઈ રહી છે. સલમાનનું નિર્દેશન કરતા પહેલાં સૂરજ બઝજાત્યા બીજી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. બીજી તરફ સલમાન ખાન પણ ૨૬ મહિનાથી અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. સૂરજ બઝજાત્યા અને સલમાન ખાન બંનેના વ્યસ્ત શેડ્યૂલને કારણે ફિલ્મ થોડી આગળ ધપાવવામાં આવી છે. આ સમાચાર ચાહકો માટે ખૂબ જ રોમાંચક છે. જો સૂત્રોનું માનીએ તો,



આ તેના પ્રકારની એક મોટી ડ્રામા ફિલ્મ હશે, જે વર્ષો સુધી યાદગાર રહેશે. આ આગામી ફિલ્મ સિવાય સલમાન ખાન અને સૂરજ બઝજાત્યાએ ૪ સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સલમાન ખાને ૧૯૯૯માં સૂરજ બઝજાત્યા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મૈને પ્યાર કિયા'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય બંનેએ 'હમ સાથ સાથ હે', 'હમ આપકે હૈ કૌન' અને 'પ્રેમ રતન ધન પાયો'માં કામ કર્યું છે.

બ્રેસ્ટ કેન્સર સામે ઝગમગ છે દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખ, ૨૦૨૨માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા

આશા પારેખે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી



દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખને રવિવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં તેમને બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ૮૨ વર્ષીય અભિનેત્રીને રવિવારે સવારે ૮ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીંના ઓપરેશન થિયેટરમાં બે કલાક સુધી તેમની સર્જરી કરવામાં આવી હતી. ૬૦ અને ૭૦ના દાયકાની સૌથી પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખને ૨૦૨૨માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો સર્વોચ્ચ એવોર્ડ છે. આ એવોર્ડ અભિનેત્રીને ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો હતો. આશા પારેખને ૬૮મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. દાદાસાહેબ ફાળકેથી સન્માનિત થનાર છેલ્લી મહિલા ગાયિકા આશા ભોંસલે હતાં. તેમને ૨૦૦૦માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આશા પારેખ પહેલાં આશા ભોંસલે, લતા મંગેશકર, દુર્ગા ખોટે, કાનન દેવી, સુબી મેયર્સ, દેવિકા રાની પણ આ એવોર્ડ મેળવી ચૂક્યાં છે. દેવિકા રાની વર્ષ ૧૯૬૯માં આ એવોર્ડ મેળવનારા પ્રથમ અભિનેત્રી હતાં. આશાનો જન્મ ૨ ઓક્ટોબર ૧૯૪૨ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. ગુજરાતી પરિવારમાં જન્મેલા આશા હાલમાં ડાન્સ એકેડમી 'કારા ભવન' ચલાવી રહી છે. આ ઉપરાંત તેમની હોસ્પિટલ 'મ્હલ હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર' પણ મુંબઈના સાંતાક્રુઝમાં ચાલી રહી છે. આશા ઈન્ડસ્ટ્રીમાં 'જ્યુબિલી ગર્લ' તરીકે પણ જાણીતાં છે. આ કારણ છે કે તેમની ફિલ્મો ૨૫ અઠવાડિયાંથી વધુ સમય સુધી થિયેટરોમાં ચાલી હતી. આશાએ માત્ર ૧૦ વર્ષની ઉંમરે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૫૨માં રિલીઝ થયેલી ફિલ્મ 'આસમાન'માં પહેલીવાર બાળકલાકાર તરીકે કામ કર્યું હતું.

સિંગર ગુરુ રંધાવા કુછ ખટ્ટા હો જાય સાથે બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરવા માટે તૈયાર છે



કુછ ખટ્ટા હો જાય, બોલિવૂડમાં ગુરુ રંધાવાની અભિનયની શરૂઆત ચિહ્નિત કરે છે, ૧૬ ફેબ્રુઆરીએ સ્ક્રીન પર આવશે

અમદાવાદ, તા.૧૩ | જાણીતા ગાયક, ગીતકાર અને સંગીતકાર, ગુરુ રંધાવા, આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ “કુછ ખટ્ટા હો જાય” દ્વારા બોલિવૂડમાં તેમના અભિનયની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, ઈલા અરુણ, અનુભ શ્રીવાસ્તવ, પરેશ ગણાત્રા અને પરિતોષ ત્રિપાઠી જેવા દિગ્ગજ કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. મુખ્ય કલાકારો શુક્રવારે હૃદયસ્પર્શી કૌટુંબિક કોમેડીને પ્રમોટ કરવા માટે અમદાવાદના બેલ્વેડર ગોલ્ડ એન્ડ કન્સ્ટ્રી કલબમાં આવ્યા હતા. મૂવી વિશે બોલતા, ગુરુ રંધાવાએ કહ્યું, “કુછ ખટ્ટા હો જાયમાં આવા સ્ટાર કલાકારો સાથે કામ કરવું એ એક રોમાંચક અનુભવ હતો. ફિલ્મ બનાવવા માટે સમગ્ર કાસ્ટ અને કૂએ ખૂબ જ મહેનત કરી છે. તે સંપૂર્ણ પારિવારિક મનોરંજન છે. અમે વિશ્વાસ છે કે તે પ્રેક્ષકો સાથે તાલ મેળવશે અને તેમને તેના પ્રેમમાં પડી જશે.” પ્રખ્યાત ગાયક અને સંગીતકારે પણ બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરવાની તક

બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું, “હું દરેકનો આભારી છું જેમણે મૂવીમાં મુખ્ય ભૂમિકા માટે મને વિચાર્યો. હું હંમેશા અભિનય પ્રત્યે આકર્ષિત હતો અને કુછ ખટ્ટા હો જાયનો ભાગ બનવું એ અતિવાસ્તવ અનુભવ છે. મારી પહેલી જ ફિલ્મમાં અનુપમ ખેર સર જેવા પીઠ અભિનેતા સાથે કામ કરવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. હું તેની પાસેથી ઘણું શીખ્યો છું.” જી અશોક દ્વારા નિર્દેશિત, “કુછ ખટ્ટા હો જાય” આગ્રાના એક યુવાન યુગલની વાર્તા છે. તે પ્રેમ, હાસ્ય અને નાટકના સ્પર્શની હૃદયસ્પર્શી વાર્તા છે, જે હીર અને રાનીના સંઘર્ષ અને વિજયને દર્શાવે છે, જેનું ચિત્રણ અનુક્રમે ગુરુ રંધાવા અને સાઈ માંજરેકર દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે હીરને અભ્યાસમાં ઓછો રસ છે, રાની તેની કારકિર્દી માટે ગંભીર છે અને વિશ્વને બદલવા માટે કંઈક કરવા માંગે છે. હીર રાની અને તેના સપનાઓને ટેકો આપવાનું ચાલુ રાખે છે, પરંતુ પરિવારની કેટલીક અન્ય યોજનાઓ છે. રાનીની યોજનાઓ ટોસ માટે જાય છે કારણ કે પરિવાર તેમના લગ્ન કરે છે. પરંતુ હીર તેને ટેકો આપવા માટે વિવિધ યોજનાઓ સાથે આવે છે. “કુછ ખટ્ટા હો જાય” પ્રેક્ષકોને પ્રેમ, હાસ્ય અને અણધાર્યા વળાંકોથી ભરેલી સફર પર લઈ જવાનું વચન આપે છે. અમિત ભાટિયા અને લલિતા ભાટિયા દ્વારા નિર્મિત, આ ફિલ્મ ૧૬ ફેબ્રુઆરીએ દેશભરમાં સિનેમાઘરોમાં આવવાની છે.

લોક સાહિત્ય સંગીત અને સંસ્કૃતિના નવી પેઢીમાં સિંચન અર્થે પ્રતિ વર્ષે આ સ્પર્ધાનું આયોજન થશે : પરશોત્તમભાઈ રૂપાલા

અમરેલી જિલ્લાના કલાકારોની સુખમ શક્તિઓને બહાર લાવવાના શુભ હેતુ સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય પશુપાલન મત્સ્યદ્યોગ અને ડેરી મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા અમરેલી સ્થિત કે.કે.પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય (નૂતન મિડલ સ્કૂલ)ના પ્રાંગણમાં યોજાઈ હતી. ઈકંકો અને એન.સી.યુ. આઈના ચેરમેનશ્રી દિવિપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જિલ્લા કક્ષાની સ્પર્ધાના સમારોહમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલા વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કક્ષાએ વિજેતા થનારા ખેલાડીઓને રજત ચંદ્રકોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ઉદ્ઘાટન સમારંભમાં ધોળ, લોકગીત, મંજરા વાદન, સુગમ સંગીત અને રાસની રમઝટની પ્રસ્તુતિઓ નિહાળી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી, પરશોત્તમ ભાઈ રૂપાલાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ સાંસદશ્રીઓને ખેલાડીઓ અને કલાકારોને મંચ આપવાના હેતુથી આ પ્રકારની સ્પર્ધાઓ યોજવાનું સૂચન કર્યું હતું. અમરેલી જિલ્લાને ભાષા તેમજ કલા વારસામાં મળી છે. અમરેલી એવા કવિ હંસની નગરી છે જેમણે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અંગ્રેજોની



માફી ન માંગવાના બદલે જેલવાસ પસંદ કર્યો હતો. અમરેલી રમેશ પારેખની નગરી છે. કવિ ગણ, મેઘાણી, કાંન, કાનજી ભુટ્ટા બારોટ વગેરે જેવા મુદ્દન્ય સાહિત્યકારો, કવિઓનો અમરેલીને વારસો મળ્યો છે. તેમણે ઉમેર્યું કે, કલા અને સંસ્કૃતિના વારસાનું સિંચન નવી પેઢીમાં થાય તેવા શુભ આશયથી આ સ્પર્ધાને ફક્ત એક વર્ષ કે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા તરીકે નહીં પરંતુ કાયમી ધોરણે યોજવામાં આવે તેવું સહિયારું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાઓ પૈકી રામસાગર, ધોળ, બેજો, પ્રભાતિયા, મંજરા વાદનને સાંસ્કૃતિક સ્પર્ધામાં કેન્દ્રીય મંત્રીશ્રીની પ્રેરણાથી સૌ પ્રથમ વખત સ્થાન મળ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ઈકંકો અને એન.સી.યુ.આઈના ચેરમેનશ્રી દિલીપ ભાઈ સંઘાણીએ કલા સંસ્કૃતિકને જીવંત રાખવાના કેન્દ્રીય મંત્રીશ્રીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો દ્વારા કલા સંસ્કૃતિ અને વારસાને જીવંત રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી નવી પેઢીમાં પોતાના વારસાનું મહત્વ જળવાઈ રહે.

આજનું રાશિ ભવિષ્ય.....

મેષ (અ,લ,ઇ) : આજના દિવસે વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કેલેરી ધરાવતો ખોરાક ટાળવો. જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલી માં ફસાઈ શકે છે. તેથી તમને સલાહ આપવા માં આવે છે કે ટેક્સ ચોરી ના કરો. તમારા સમસ્ત પરિવાર માટે સમૃદ્ધિ લાવે તેવા પ્રોજેક્ટની તમારે પસંદગી કરવી જોઈએ. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે.

વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે. તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હંચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. તમે જીવનમાં પૈસા ના મહત્વ નથી સમજતા પરંતુ આજે તમને પૈસા નું મહત્વ સમજ આવી શકે છે. કેમકે તમને આજે પૈસા ની સખત જરૂર પડી શકે છે.

સિંહ (મ,ટ) : આજના દિવસે તમારે તમારી લાગણીઓ પર અંકુશ મુકવો પડશે તથા તમારા ભવ્યથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો.

કન્યા (પ,ઠ,ણ) : આજના દિવસે આજે તમે જે કંઈ કરશો તેમાં-ઉજાઈથી સભર હશે-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકાશો. જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમય નું ધ્યાન રાખો કેમકે સમાન ચોરી થવા ની શક્યતા છે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે.

ધન (ભ,ધ,ફ) : આજના દિવસે માનસિક તણા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર માં કોઈ ફંક્શન હોવા ને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ. પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ.

મકર (બ,જ) : આજના દિવસે મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્ત્રીસ્ત્રી દૂર રહો. નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે, જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. આ રાશિ તેમના સંબંધમાં જરૂર થી વધારે બોલવાથી બચવું જોઈએ નહીંતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે.

જામનગર તાલુકાના રાવલસર ગામમાં બાળકો માટે તમાકુ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

જામનગરની ટીમ દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગર તાલુકાના લાખાબાવળ પી.એચ. સી.ના રાવલસર ગામ ખાતે ઉત્તર ભુનિયાદી માધ્યમિક શાળામાં તમાકુ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, તમાકુથી થતાં નુકસાન વિષે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત કાયદા વિષે અને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન, આઈ.ઈ.સી. એક્ટિવિટી, વકતુલ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના અંતે વિજેતા



બાળકોને ઈનામ વિતરણ અને ધૌણિક નાસ્તો આપવામાં આવ્યો હતો. જી.સરકારી હોસ્પિટલ, જામનગરમાંથી માનસિક આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકોને માનસિક બીમારીઓ વિષે માહિતી, માર્ગદર્શન અને તેના ઉપચાર વિષે જાગૃત કરાયા હતા. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના જિલ્લા કક્ષાના કાર્ટિસ્ટેબલ શ્રી નજમાબેન હાલાએ “tobacco free education institutions” કરવા માટેની કામગીરી વિષે શાળાના સ્ટાફગણને માર્ગદર્શન આપ્યું હતું.

વઘઈમા સરકારી કચેરીઓમાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો

જામનગર, તા.૧૩ | ગાંધી જિલ્લામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન વઘઈ તાલુકામાં સામુહિક દવા વિતરણના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય ડેડક અને ગાંધીના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, સ્વયં ગોળી ગળી તાલુકાના તમામ લક્ષિત લાભાર્થીઓને ગોળી ગળવાની અપીલ કરી હતી. ત્યારે વઘઈ તાલુકામાં હાથ ધરાયેલા સામુહિક દવા વિતરણ કાર્યક્રમમાં વઘઈ કોર્ટ, તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી, અને નારી અદાલત કચેરીના તમામ કર્મીઓએ, આરોગ્ય વિભાગ દ્વારા હાથિપગાને દેશવટો આપવાના કાર્યને આવકારી સામુહિક દવા ગળી અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. વઘઈ કોર્ટ, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને નારી અદાલતમાં આરોગ્યકર્મીઓ દ્વારા “ડોટપધ્ધતી” મુજબ રૂબરૂ મારેકને DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામાં આવી હતી. ફાઇલેરિયા મુક્ત ભાવી પેઢી માટે આ દવા લેવી ખૂબ જરૂરી છે.

વઘઈમા સરકારી કચેરીઓમાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો

જામનગર, તા.૧૩ | ગાંધી જિલ્લામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન વઘઈ તાલુકામાં સામુહિક દવા વિતરણના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય ડેડક અને ગાંધીના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, સ્વયં ગોળી ગળી તાલુકાના તમામ લક્ષિત લાભાર્થીઓને ગોળી ગળવાની અપીલ કરી હતી. ત્યારે વઘઈ તાલુકામાં હાથ ધરાયેલા સામુહિક દવા વિતરણ કાર્યક્રમમાં વઘઈ કોર્ટ, તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી, અને નારી અદાલત કચેરીના તમામ કર્મીઓએ, આરોગ્ય વિભાગ દ્વારા હાથિપગાને દેશવટો આપવાના કાર્યને આવકારી સામુહિક દવા ગળી અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. વઘઈ કોર્ટ, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને નારી અદાલતમાં આરોગ્યકર્મીઓ દ્વારા “ડોટપધ્ધતી” મુજબ રૂબરૂ મારેકને DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામાં આવી હતી. ફાઇલેરિયા મુક્ત ભાવી પેઢી માટે આ દવા લેવી ખૂબ જરૂરી છે.

થરા નગરમાં માણિભદ્રવીર દાદાનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

થરા, તા.૧૩ | કાંકરેજ તાલુકાની થરા નગરની પુણ્ય ભૂમિમાં જુનાગામ તળમાં દરબાર ગઢના મુખ્ય દ્વાર પાસે પ્રાચીન શ્રી માણિભદ્રવીર દાદાનું મંદિર આવેલ છે. જેનો નયનાબેન ભુપેન્દ્રભાઈ રતિલાલ ધાણધારા પરિવાર દ્વારા જીર્ણોદ્ધાર ભવ્યાતિ ભવ્ય રીતે કરી ગઈ તા.૧૨/૨/૨૪ મહા સુદ-૩ને સોમવાર થી મહા સુદ-૫ ને બુધવાર તા. ૧૪/૦૨/૨૦૨૪ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શ્રીમદ્ ગચ્છાધિપતી વિજય કુલચંદ્રસુરી ચરજી (કે. સી.) મહારાજ આદિ ઠાણાની પાવન નિશામાં આજે સંપન્ન થશે. પ્રસંગે તા. ૧૨/૦૨/૨૪ થી સવારે ૬.૩૦ કલાકે પ્રભાતિયાં, પૂજ્ય ગુરૂ ભાગવંતોનું સામૈયુ તથા માણિભદ્રવીર દાદાનો નગર પ્રવેશ ગજરાજ બગી ઢોલ નગરા શરણાઈઓના સુરો વચ્ચે થયેલ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,



પાલીકા પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલા,કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજભાઈ કે. શાહ, વિનોદભાઈ શાહ, અરવિંદભાઈ શાહ, ભૂપેન્દ્ર ભાઈ શાહ, જીતુભાઈ શાહ, હર્ષદ ભાઈ શાહ, વિરલભાઈ શાહ, દિનેશભાઈ શાહ જેન શ્રેષ્ઠીઓ સહિત નગરજનોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા સિદ્ધશીલા સોસાયટી થી નીકળી હાઈવે રોડ, પાલિકા રોડઝાવડા વાલીનાથ રોડ, તેરવાડિયા વાસ, હાઈસ્કુલ રોડ થઈ જુનાગામતળમાં માણિભદ્ર વીર દાદા દરબાર ગઢ પાસે પૂર્ણ થયેલ હતી.

પદમાજીની મુવાડી ગામે પાટોત્સવ



તસ્વીર : ભરતભાઈ પંડ્યા, દિવડા કોલોની

કડાણા તાલુકાના પદમાજીની મુવાડી ગામે ચામુંડા માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પંચકુંડી મહાદેવના આયોજન દ્વારા ગામના અનેક આગેવાનો તેમજ ભાવિક ભક્તોએ ધન્યતાનો લાભ લીધો. ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ મહાદેવ નો પ્રારંભ થયો હતો.રાતે રાસ ગરબાની રમઝટ મચાવીહતી જેથી કરીને સમગ્ર વાતાવરણ ભક્તિમય તેમજ આનંદમય બન્યું હતું. આચાર્યશ્રી ભદ્રેશભાઈ શાસ્ત્રીજીદ્વારા સમગ્ર પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.



ગુજરાત હોસ્પિટાલિટી ભારતભરમાંથી ઉભરતા ખેલાડીઓની રાહ જોઈ રહ્યું છે



જામનગર, તા.૧૩ | ૩૦૦ એકરમાં ફેલાયેલું ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ૧૬ ફેબ્રુઆરીથી એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI)ની ફેલોશિપ ઈવેન્ટ-NIDJAM (નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ)ની ૧૯મી આવૃત્તિનું આયોજન કરશે. જ્યારે NIDJAM ગુજરાતમાં ગ્રાસરૂટ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપશે, ત્યારે તે ભારતની મોટી ઈવેન્ટ્સ યોજવાની ક્ષમતાને પણ પ્રદર્શિત કરશે કારણ કે સરકારે ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સ માટે બિડ કરવા માટે રસ દર્શાવ્યો છે. AFI અમદાવાદમાં ૧૬ થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંકલનમાં NIDJAM કરશે. ત્રણ દિવસીય ઈવેન્ટમાં ૬૧૫ જિલ્લામાંથી ૫,૫૫૮ ખેલાડીઓએ ભાગ લીધો છે. આ સ્પર્ધા U14 અને U16 છોકરાઓ અને છોકરીઓના જૂથોમાં યોજાશે. દરેક જિલ્લો ૧૩ સભ્યોની ટીમને મેદાનમાં ઉતારવા માટે પાત્ર છે,

જેમાં એક પુરુષ અને એક મહિલા અધિકારીનો સમાવેશ થાય છે. તમામ જિલ્લાની ટીમો મુસાફરી ભથ્થું અને ફીમાં રહેવા માટે હકદાર છે. ત્રણ દિવસીય સ્પર્ધા દેશના દૂરના વિસ્તારોના યુવાનોને એક મોટા પ્લેટફોર્મ પર તેમની ક્ષમતા દર્શાવવાની તક આપશે. “ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સારી સુવિધાઓ છે, જેમાં સિન્થેટિક ટ્રેક અને વિશાળ વોર્મ-અપ એરિયાનો સમાવેશ થાય છે,” એએફઆઈના પ્રમુખ અદિલ સુમરીવાલાએ જણાવ્યું હતું. આયોજકોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ સમુદાયને ભારતમાં સૌથી મોટા પાયાના કાર્યક્રમના સાક્ષી બનાવવા માટે આમંત્રિત કર્યા છે. આ પ્રસંગે વર્લ્ડ એથ્લેટિક્સના કિડ્સ એથ્લેટિક્સ મેનેજર કેથરિન ઓ’સુલિવાન, દક્ષિણ અમેરિકાના એરિયા પ્રેસિડેન્ટ હેલિયો ગેસ્ટા ડી મેલો અને ઓસેનિયાના મેમ્બર કાર્લિસલ ઓફ વર્લ્ડ એથ્લેટિક્સ રોબિન સપોંગ યુજેનિયો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે પ્રેમની મોસમની ઉજવણી કરો

અમદાવાદ, તા.૧૩ | હવાઓમાં પ્રેમ નો માહોલ છે અને નેક્સસ અમદાવાદ વન મોલ એ આ વેલેન્ટાઈન ડે પર પ્રેમની સિંચનની ઉજવણી કરવા માટે યોગ્ય સ્થળ છે. મોલ થીમેટિક ડેકોર, હૅગિંગ્સ અને સેટઅપ્સથી શણગારવામાં આવ્યો છે, જે રોમેન્ટિક સેલ્ફી અને પ્રિય યાદોને માટે આદર્શ બેકગ્રાઉન્ડ બનાવે છે. લાલ વસ્ત્રો પહેરીને મોલમાં પ્રવેશ કરો અને વિશિષ્ટ ફેશન, ફૂડ અને જવેલરી વાઉચર જીતવાની તક મેળવો. આ તક ચૂકી ન જવાય. પ્લાઝા એરિયામાં સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી લાઈવ મ્યુઝિક પર્ફોર્મન્સ સાથે પ્રેમના ધબકારાનો અનુભવ કરો. પ્રેમની ધૂન સાથે વેલેન્ટાઈન ડેની ભાવનામાં ડૂબી જાવ. વિવિધ બ્રાન્ડ્સ પર ખાસ વેલેન્ટાઈન મેનુનો આનંદ માણો, અને ખરીદી કરવાનું ચૂકશો નહીં, ફૂડ કોર્ટમાં કેટલાક ખાસ ક્યુરેટેડ મોકટેલ શોટ્સ સાથે સૌથી સ્વાદિષ્ટ વાનગીઓ પર ફ્રી ઓફર મેળવો. Hamley’s ના કડલી ટેડી બેર માર્કેટ સાથે સરસ ફોટો ખેંચવાની તક માટે અમારી સાથે



સાથે જોડાઈ જાવ. પ્રેમથી ભરેલી પળોને કેચર કરો અને જીવનભર ટકી રહે તેવી યાદો બનાવો. આ વેલેન્ટાઈન ડે, નેક્સસ અમદાવાદ વન મોલ પ્રેમના તમામ સ્વરૂપોમાં ઉજવવા આમંત્રણ આપે છે. ભલે તમે તમારી જાત સાથે ઉજવણી કરી રહ્યા હોવ કે, પ્રિયજનો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવતા હોવ, અથવા તે ખાસ વ્યક્તિ સાથે નવી યાદો રચતા હોવ, અમારી વેલેન્ટાઈન ડેની ઉજવણી અવિસ્મરણીય રહેવાનું વચન આપે છે.

મેષ (અ,લ,ઇ) : આજના દિવસે વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કેલેરી ધરાવતો ખોરાક ટાળવો. જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલી માં ફસાઈ શકે છે. તેથી તમને સલાહ આપવા માં આવે છે કે ટેક્સ ચોરી ના કરો. તમારા સમસ્ત પરિવાર માટે સમૃદ્ધિ લાવે તેવા પ્રોજેક્ટની તમારે પસંદગી કરવી જોઈએ. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે.

સિંહ (મ,ટ) : આજના દિવસે તમારે તમારી લાગણીઓ પર અંકુશ મુકવો પડશે તથા તમારા ભવ્યથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો.

ધન (ભ,ધ,ફ) : આજના દિવસે માનસિક તણા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર માં કોઈ ફંક્શન હોવા ને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ. પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ.

વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે. તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હંચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. તમે જીવનમાં પૈસા ના મહત્વ નથી સમજતા પરંતુ આજે તમને પૈસા નું મહત્વ સમજ આવી શકે છે. કેમકે તમને આજે પૈસા ની સખત જરૂર પડી શકે છે.

કન્યા (પ,ઠ,ણ) : આજના દિવસે આજે તમે જે કંઈ કરશો તેમાં-ઉજાઈથી સભર હશે-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકાશો. જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમય નું ધ્યાન રાખો કેમકે સમાન ચોરી થવા ની શક્યતા છે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે.

મકર (બ,જ) : આજના દિવસે મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્ત્રીસ્ત્રી દૂર રહો. નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે, જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. આ રાશિ તેમના સંબંધમાં જરૂર થી વધારે બોલવાથી બચવું જોઈએ નહીંતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે.

મિથુન (ક,ઇ,ઘ) : આજના દિવસે તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડશે. ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની શણગાર લાવશે. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાંચ પર અસર

કોહલીની ગેરહાજરીમાં સિરીઝ જીતવા ઇંગ્લેન્ડને ઘણો લાભ મળી શકે : ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ



। (એજન્સી) રાજકોટ, તા.૧૩ ।

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટના સોનાર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી હાલમાં ૧-૧ થી બરાબર છે. રાજકોટમાં સ્વોર્ન ટર્નિંગ પીચ જોવા મળી શકે છે, આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિનની ભૂમિકા મહત્વની બનશે. રવિચંદ્રન અશ્વિન રાજકોટમાં સ્પિન-ફ્રેન્ડલી સ્થિતિમાં ઇંગ્લેન્ડ સામે હાંગામો મચાવવા માટે તૈયાર છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવાની ખૂબ નજીક છે. ભારત માટે અત્યાર સુધી માત્ર અનિલ કુંભલે જ આ ચમત્કાર કરી શક્યા છે. રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ૮૭ ટેસ્ટ મેચમાં ૪૯૯ વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન વધુ એક વિકેટ લેવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચશે. રવિચંદ્રન અશ્વિન વધુ ૧ વિકેટ લેવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટના ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રાજકોટના મેદાન પર ભારતનો શાનદાર રેકોર્ડ, ટેસ્ટમાં અપરાજિત

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટના સોનાર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી હાલમાં ૧-૧ થી બરાબર છે. રાજકોટમાં સ્વોર્ન ટર્નિંગ પીચ જોવા મળી શકે છે, આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિનની ભૂમિકા મહત્વની બનશે. રવિચંદ્રન અશ્વિન રાજકોટમાં સ્પિન-ફ્રેન્ડલી સ્થિતિમાં ઇંગ્લેન્ડ સામે હાંગામો મચાવવા માટે તૈયાર છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવાની ખૂબ નજીક છે. ભારત માટે અત્યાર સુધી માત્ર અનિલ કુંભલે જ આ ચમત્કાર કરી શક્યા છે. રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ૮૭ ટેસ્ટ મેચમાં ૪૯૯ વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન વધુ એક વિકેટ લેવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચશે. રવિચંદ્રન અશ્વિન વધુ ૧ વિકેટ લેવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટના

। (એજન્સી) રાજકોટ, તા.૧૩ । ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટના સોનાર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી હાલમાં ૧-૧ થી બરાબર છે. રાજકોટમાં સ્વોર્ન ટર્નિંગ પીચ જોવા મળી શકે છે, આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિનની ભૂમિકા મહત્વની બનશે. રવિચંદ્રન અશ્વિન રાજકોટમાં સ્પિન-ફ્રેન્ડલી સ્થિતિમાં ઇંગ્લેન્ડ સામે હાંગામો મચાવવા માટે તૈયાર છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવાની ખૂબ નજીક છે. ભારત માટે અત્યાર સુધી માત્ર અનિલ કુંભલે જ આ ચમત્કાર કરી શક્યા છે. રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ૮૭ ટેસ્ટ મેચમાં ૪૯૯ વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન વધુ એક વિકેટ લેવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચશે. રવિચંદ્રન અશ્વિન વધુ ૧ વિકેટ લેવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટના



। (એજન્સી) રાજકોટ, તા.૧૩ । ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટના સોનાર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી હાલમાં ૧-૧ થી બરાબર છે. રાજકોટમાં સ્વોર્ન ટર્નિંગ પીચ જોવા મળી શકે છે, આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિનની ભૂમિકા મહત્વની બનશે. રવિચંદ્રન અશ્વિન રાજકોટમાં સ્પિન-ફ્રેન્ડલી સ્થિતિમાં ઇંગ્લેન્ડ સામે હાંગામો મચાવવા માટે તૈયાર છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવાની ખૂબ નજીક છે. ભારત માટે અત્યાર સુધી માત્ર અનિલ કુંભલે જ આ ચમત્કાર કરી શક્યા છે. રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ૮૭ ટેસ્ટ મેચમાં ૪૯૯ વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિન વધુ એક વિકેટ લેવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચશે. રવિચંદ્રન અશ્વિન વધુ ૧ વિકેટ લેવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટના

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રાજકોટના મેદાન પર ભારતનો શાનદાર રેકોર્ડ, ટેસ્ટમાં અપરાજિત

। (એજન્સી) રાજકોટ, તા.૧૩ । ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ૫ મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટના સોનાર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. જે બાદ ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતી સીરિઝ ૧-૧ થી બરાબર કરી હતી. હવે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં બંને ટીમોની નજર સીરિઝમાં લીડ મેળવવા પર રહેશે. આ મેદાન પર ભારતનો રેકોર્ડ શાનદાર છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમે બે ટેસ્ટ મેચ રમી છે. અહીં પ્રથમ ટેસ્ટ મેચ નવેમ્બર ૨૦૧૬માં રમાઈ હતી. આ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ડ્રો થઈ હતી. તે મેચમાં

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રાજકોટના મેદાન પર ભારતનો શાનદાર રેકોર્ડ, ટેસ્ટમાં અપરાજિત

। (એજન્સી) રાજકોટ, તા.૧૩ । ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ૫ મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટના સોનાર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. જે બાદ ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતી સીરિઝ ૧-૧ થી બરાબર કરી હતી. હવે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં બંને ટીમોની નજર સીરિઝમાં લીડ મેળવવા પર રહેશે. આ મેદાન પર ભારતનો રેકોર્ડ શાનદાર છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમે બે ટેસ્ટ મેચ રમી છે. અહીં પ્રથમ ટેસ્ટ મેચ નવેમ્બર ૨૦૧૬માં રમાઈ હતી. આ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ડ્રો થઈ હતી. તે મેચમાં

અંડર-૧૯ વર્લ્ડકપ ૨૦૨૪ માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર આઈસીસીની ટીમમાં ભારતના ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું કેપ્ટન ઉદય સહારન અને સ્ટાર બેટર મુશીર ખાન સહિત બેટર સચિન ઘાસ અને સ્પિનર સૌમ્ય પાંડેનો સમાવેશ

। (એજન્સી) દુબઈ, તા.૧૩ । આઈસીસીએ ગઈકાલે અંડર-૧૯ વર્લ્ડકપ ૨૦૨૪ માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરી હતી. આ ટીમમાં ભારતીય ટીમના એક-બે નહીં પરંતુ ૪ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આઈસીસીએ જાહેર કરેલી ટીમમાં કેપ્ટન ઉદય સહારન અને સ્ટાર બેટર મુશીર ખાન સહિત બેટર સચિન ઘાસ અને સ્પિનર સૌમ્ય પાંડેને પણ સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હુગ વીબગેને ટીમ ઓફ ધ ટુર્નામેન્ટના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટીમની પસંદગી મીડિયા, બ્રોડકાસ્ટર્સ અને આઈસીસીપ્રતિનિધિઓની પેનલ દ્વારા કરવામાં આવી હતી. ભારતના ચાર ખેલાડીઓ ઉપરાંત, આઈસીસીએ ટુર્નામેન્ટની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ, સાઉથ આફ્રિકાના બે ખેલાડીઓ અને વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનના એક-એક ખેલાડીને ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સામેલ કર્યા છે. સ્કોટલેન્ડના જેમી

। (એજન્સી) દુબઈ, તા.૧૩ । આઈસીસીએ ગઈકાલે અંડર-૧૯ વર્લ્ડકપ ૨૦૨૪ માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરી હતી. આ ટીમમાં ભારતીય ટીમના એક-બે નહીં પરંતુ ૪ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આઈસીસીએ જાહેર કરેલી ટીમમાં કેપ્ટન ઉદય સહારન અને સ્ટાર બેટર મુશીર ખાન સહિત બેટર સચિન ઘાસ અને સ્પિનર સૌમ્ય પાંડેને પણ સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હુગ વીબગેને ટીમ ઓફ ધ ટુર્નામેન્ટના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટીમની પસંદગી મીડિયા, બ્રોડકાસ્ટર્સ અને આઈસીસીપ્રતિનિધિઓની પેનલ દ્વારા કરવામાં આવી હતી. ભારતના ચાર ખેલાડીઓ ઉપરાંત, આઈસીસીએ ટુર્નામેન્ટની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ, સાઉથ આફ્રિકાના બે ખેલાડીઓ અને વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનના એક-એક ખેલાડીને ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સામેલ કર્યા છે. સ્કોટલેન્ડના જેમી

ખેલ જગત માટે એક ચોંકાવનારા સમાચાર ઈન્ડોનેશિયામાં ફૂટબોલની ફેન્ડલી મેચમાં વીજળી પડતાં ખેલાડીનું મોત આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

। (એજન્સી) જાવા, તા.૧૩ । ખેલ જગત માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડી પર વીજળી પડી હતી. આ ખેલાડીનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં શનિવારે એફસીબેનુંગ અને એફબીઆઈશુબેંગ વચ્ચે ફેન્ડલી મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન આ વીજળી મેચ રમી રહેલા એક ખેલાડી પર પડી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેચ ખરાબ હવામાન વચ્ચે રમાઈ રહી હતી. આ દરમિયાન



। (એજન્સી) જાવા, તા.૧૩ । ખેલ જગત માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડી પર વીજળી પડી હતી. આ ખેલાડીનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં શનિવારે એફસીબેનુંગ અને એફબીઆઈશુબેંગ વચ્ચે ફેન્ડલી મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન આ વીજળી મેચ રમી રહેલા એક ખેલાડી પર પડી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેચ ખરાબ હવામાન વચ્ચે રમાઈ રહી હતી. આ દરમિયાન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રાહુલ અનફિટ જાહેર થયો

। (એજન્સી) રાજકોટ, તા.૧૩ । ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી શરૂ થનારી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ અગાઉ ભારતીય ટીમનો સિનિયર બેટ્સમેન કે એલ રાહુલ અનફિટ જાહેર થયો છે અને ઈજાને કારણે રમી શકશે નહીં. તે પોતાની ઈજામાંથી હજી સુધી સંપૂર્ણ ફિટ થયો નથી. ત્રીજી ટેસ્ટ માટે રાહુલને સ્થાને દેવદત્ત પડિકલને ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. આ અગાઉ રાહુલ વિશાખાપટ્ટનમ ખાતેની ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો. દેવદત્ત પડિકલ વર્તમાન ડોમેસ્ટિક સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે કે એલ રાહુલ હજી સુધી રાજકોટ પહોંચ્યો નથી. રવીન્દ્ર જાડેજા ટીમની સાથે જોડાઈ ચૂક્યો છે. ફિટનેસની શરત હંમેશાં રહેતી હોય છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમને હજી સુધી તેની ફિટનેસ અંગે આત્મવિશ્વાસ નથી.

બોડી શેમિંગ કોમેન્ટ કરનારા યુઝર્સને બુમરાહની પત્નીએ ફટકાર લગાવી ભાભી જાડી દેખાઈ રહી છે, આના પર સંજનાએ લખ્યું, સ્કૂલના વિજ્ઞાનના પુસ્તકો તો યાદ થતા નથી અનેમહિલાઓના શરીર પર કોમેન્ટ કરો છો, ભાગો અહીંથી



। મુંબઈ, તા.૧૩ । ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લીધા બાદ જસપ્રીત બુમરાહ ગુરુવારે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ફરી એકશનમાં દેખાશે. પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ ભારતીય ટીમે જીતી સીરિઝ ૧-૧ થી બરાબર કરી લીધી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ મેચમાં ૯ વિકેટ લઈને ભારતને સીરિઝ બરાબર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેચ બાદ

ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીઓની જેમ બુમરાહે પણ પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.બુમરાહે તેની પત્ની સંજના ગણેશન સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જણાવી દઈએ કે સંજના એક જાણીતી સ્પોર્ટ્સ એક્ટર છે. હાલમાં જ આ કપલે તેમનાં પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. જો કે સંજના ગણેશન પર એક યુઝરે બોડી શેમિંગ કોમેન્ટ કરી હતી. આ માટે બુમરાહની પત્નીએ તેને ફટકાર લગાવી હતી.યુઝરે કોમેન્ટ કરી,

“ભાભી જાડી દેખાઈ રહી છે.” આના પર સંજનાએ લખ્યું, “સ્કૂલની વિજ્ઞાનની પુસ્તકો તો યાદ થતી નથી તમારાથી, મહિલાઓના શરીર પર મુખ કોમેન્ટ કરી રહ્યા છો. ભાગો અહીંથીપ” સંજનાગણેશનના આ જવાબના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. આવા કોટા પર ટિપ્પણી કરવી એ કોઈ પણ સંજોગોમાં રમુજી નથી. સંજનાએ હાલમાં જ પુત્રને જન્મ આપ્યો હતો અને ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવું સ્વાભાવિક છે.

વિશેષ

આર્થિક વિકાસ માટે સશક્ત બનવા માટે સ્કિલ ડેવલપ કરો : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

રાજ્યના આઠ જિલ્લાના આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કચ્છ આત્મીય સંવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ

। (માહિતી) અમદાવાદ । રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહમાં પીએમ-જનમન કાર્યક્રમ હેઠળ રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ આર્થિક વિકાસ માટે સશક્ત બનવા માટે સ્કિલ ડેવલપ કરવા આહ્વાન કર્યું હતું. વધુમાં તેમણે સરકાર દ્વારા આદિમજૂથોના વિકાસ માટે પીએમ જન મન અભિયાન હેઠળ યોજનાકીય લાભો લેવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિશ્રીએ આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે પી.એમ. જનમન પહેલ અને તેના થકી પ્રાપ્ત યોજનાકીય લાભો અંગે લાભાર્થીઓને પૃષ્ઠા કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૧ કરોડથી વધુ આદિવાસી બંધુઓ, જેમાંથી દોઢ લાખ આદિમજૂથમાં સમાવિષ્ટ છે. ત્યારે અહીં ઉપસ્થિત આદિમજૂથમાંથી કેટલા લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, મેટ્રિક અને નોન મેટ્રિક પાસ છે તેમજ કેટલા લોકો નોકરી કરે છે, રાજકારણમાં છે તે અંગે પૃષ્ઠા કરી જણાવ્યું કે, સરકાર આવાસ, પાણી, વીજળી, સ્કૂલ, દવાખાના સહિતની બધી જ સુવિધા આપવા તૈયાર છે, ત્યારે તમારે પણ જાગૃતિ દાખવવાની જરૂર છે. કોઈ પણ લાભાર્થી સરકારની યોજનાના



લાભથી વંચિત ન રહે તે માટે જાગૃત બનવાનું છે. તમારે તમારા બાળકોને ભણાવવાના છે, શિક્ષિત બનાવવાના છે. તેમણે ઉમેર્યું કે, આર્થિક વિકાસ માટે સશક્ત બનવા સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે. સ્કીલથી જ આત્મનિર્ભર બની શકાશે. આપણે એટલા સક્ષમ બનવું જોઈએ કે કોઈના પર નિર્ભર ન રહીએ. સરકાર વ્યાજ વગરની લોન આપે છે, તમારે વિચાર કરવાનો છે કે, હું શું કરું નવું કરી શકું. તમે આગળ વધશો તો દેશ પણ આગળ વધશે અને સશક્ત ભારતનું નિર્માણ થશે. વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિકનું યોગદાન મહત્વનું છે. વધુમાં રાષ્ટ્રપતિશ્રી એ હું તમારા બધામાંથી જ એક છું એમ કહી જણાવ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ,

સબકા વિશ્વાસ’નો નારો હું સફળ થતો જોઈ રહી છું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઠ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે પીએમ જન મન અભિયાન શરૂ કરાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ દેશને વિકસિત ભારતમાં પરિવર્તિત કરવા માટે સંકલ્પ લીધો છે. જે માટે પીએમ જન-મન મહાઅભિયાન તરીકે શરૂ કરાયું છે. આદિવાસીઓના કલ્યાણ માટે બજેટ છ ગણું વધારાયું છે. આ અભિયાન થકી સરકાર ખુદ આદિવાસી ભાઈઓ બહેનોના ઘર સુધી પહોંચી છે. આપણે ‘જન મન’ ગાઈએ છીએ ત્યારે ભારતનું જન-મન આ અભિયાનથી વાસ્તવમાં જાગી ઉઠશે. લોકોના ચહેરા પર મુસ્કાન એ જ સફળતાનું પ્રમાણપત્ર છે. રાજ્યના આદિજાતિ વિભાગના અગ્ર સચિવ ડો.એસ. મુરલીકૃષ્ણને પીએમ જન મન અભિયાન હેઠળ રાજ્યમાં થયેલી કામગીરીની રુપરેખા આપી હતી. આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વારલી પેઈન્ટિંગથી રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રીનું અભિવાદન કરાયું હતું. વલસાડ,નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, અમદાવાદ અને ગીર સોમનાથ જિલ્લાના આદિમ જૂથના કોટવાળિયા/ કોલયા-કોલયા, કાથોડી, પઢાર અને સીદી સમુદાયના કુલ ૨૨૦ લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિશ્રીએ સંવાદ કર્યો હતો. તેમની સાથે આ સંવાદ કાર્યક્રમમાં સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ

(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને શામ્લોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. બોક્સ મેટર વિવિધ જિલ્લાના આદિમ જૂથના ૨૨૦ લાભાર્થીઓ સંવાદમાં જોડાયા. પીએમ-જનમન કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રપતિશ્રીએ આત્મીય સંવાદ સાથે હતો. આદિમ જૂથના લાભાર્થીઓમાં વલસાડ જિલ્લાના કોટવાળિયા/ કોલયા-કોલયા સમુદાયના ૫૦ લાભાર્થીઓ, નવસારી જિલ્લાના કોટવાળિયા/ કોલયા-કોલયા સમુદાયના ૨૫ લાભાર્થીઓ, ડાંગ જિલ્લાના કોટવાળિયા સમુદાયના ૨૦, સુરત જિલ્લાના કોટવાળિયા સમુદાયના ૨૫, તાપી જિલ્લાના કોટવાળિયા/કાથોડી/ કોલયા-કોલયા સમુદાયના ૨૫, નર્મદા જિલ્લાના કોટવાળિયા/કોલયા-કોલયા સમુદાયના ૨૫, અમદાવાદ જિલ્લાના પઢાર સમુદાયના ૨૫ અને ગીર સોમનાથ જિલ્લાના સીદી સમુદાયના ૨૫ મળી કુલ ૨૨૦ લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિશ્રીએ સંવાદ કર્યો હતો. બોક્સ મેટર આયુષ્યમાન કાર્ડ ન હોત તો હું મારી પત્નીનો જીવ બચાવી શક્યો ન હોત: લાભાર્થી મુસ્તાક મન્સુર રાષ્ટ્રપતિશ્રી સાથેના સંવાદ કાર્યક્રમમાં ગીર સોમનાથના તાલાલાના આદિમજૂથના લાભાર્થી મુસ્તાક મન્સુરે જણાવ્યું કે, મારા ઉ બાળકો આદિવાસી આશ્રમશાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ પણ મળે છે.

વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર

ગાંધીનગર જિલ્લાના ઔદ્યોગિક ભરતી મેળામાં ૪૧૮૭ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી

। ગાંધીનગર, તા.૧૩ ।

૧૫મી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભા ગૃહમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીએ ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વર્ષ ૨૦૨૩ દરમિયાન ૩૨ ઔદ્યોગિક ભરતી મેળાનું યોજવામાં આવ્યા હતા, જેમાં આશરે ૧૮૫ નોકરીદાતા દ્વારા ૪૧૮૭ જેટલા ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે, મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૫૨૨, કલોલ તાલુકાના ૧૦૭૬, ગાંધીનગર તાલુકાના ૨૩૨૭ અને માણસા તાલુકાના ૨૬૨ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે.

રાજ્યના યુવાનોને સરળતાથી રોજગારી મળી રહે તે માટે દરેક જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સ્થાનિક પાનગી એકમો સાથે સંકલન કરી તેમના એકમોમાં ખાલી જગ્યાની માહિતી મેળવી અલગ અલગ કલસ્ટર આધારિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૮૫ ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવામાં આવે છે.

વૃદ્ધો અને દિવ્યાંગોને પાંચ વર્ષમાં ૨૨૩૭ લાખથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ: મંત્રી ભીખુસિંહ પરમાર

વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય સંદર્ભે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, રાજ્યમાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના અંતર્ગત પેન્શન રૂપે સહાય ચૂકવવામાં આવે છે.

કચ્છ જિલ્લામાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય આપવા અંતર્ગત પ્રશ્નો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના અંતર્ગત ૨૩,૨૩૨ લાભાર્થીઓને રૂ. ૨૨૩૭.૫૪ લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.

વર્ષ ૨૦૨૩ દરમિયાન કચ્છ જિલ્લામાં આ યોજના હેઠળ ૫૭૫ અરજીઓ મળી હતી જેમાંથી ૫૬૮ અરજીઓ મંજૂર કરી લાભાર્થીઓને રૂ.૩૮.૭૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

અમદાવાદ સ્ટેશન પર ચાર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર



। અમદાવાદ, તા.૧૩ ।

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડતા અને ટ્રેનોની સમય પાલનને વધુ યોગ્ય બનાવવા માટે, દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ, દાદર-બીકાનેર એક્સપ્રેસ, યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બાડમેર એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક પ્રભાવ થી અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.

૧. ટ્રેન નંબર ૨૦૪૮૪ દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ નું અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૨૨:૪૫/૨૨:૫૫ ના બદલે ૨૨:૫૦/૨૩:૦૦ વાગ્યા સુધીનો રહેશે. ૨. ટ્રેન નંબર ૧૨૪૮૦ દાદર-બીકાનેર એક્સપ્રેસ નું અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૨૨:૪૫/૨૨:૫૫ ના બદલે ૨૨:૫૦/૨૩:૦૦ વાગ્યા સુધીનો રહેશે. ૩. ટ્રેન નંબર ૧૪૮૦૫ યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૧૮:૨૦/૧૮:૩૦ વાગ્યાને બદલે ૧૮:૩૦/૧૮:૪૦ વાગ્યા સુધી નો રહેશે. ૪. ટ્રેન નંબર ૧૮૦૦૮ બાંદ્રા ટર્મિનસ-બાડમેર એક્સપ્રેસ ટ્રેનનો ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ થી અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય ૦૩:૧૫/૦૩:૨૦ વાગ્યાને બદલે ૦૩:૨૦/૦૩:૩૦ વાગ્યા સુધીનો રહેશે.

ટ્રેનો ના પરિચાલનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

VS Hair Salon
Ramesh, Vishnu

2, Kadamb Complex, Judges Bungalow Road, Nr. Rajvansh Tower, Bodakdev, Ahmedabad - 380 054

97258 56958

ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતુ અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર

। (એજન્સી) અમદાવાદ, તા.૧૩ ।

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મત વિસ્તારમાં લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમ કરવાના હતા, જો કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અનિવાર્ય સંજોગોના કારણે અમિત શાહને દિલ્હી પહોંચવું પડે તેમ હતુ, જેના કારણે તેઓ કાર્યક્રમમાં ફેરફાર કરીને દિલ્હી જવાના રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મત વિસ્તારમાં લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમ કરવાના હતા, જો કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અનિવાર્ય સંજોગોના કારણે અમિત શાહને દિલ્હી પહોંચવું પડે તેમ હતુ,

જેના કારણે તેઓ કાર્યક્રમમાં ફેરફાર કરીને દિલ્હી જવા રવાના થયા હતા. અમિત શાહે વહેલી સવારે જે બેઠક હતી તેમાં હાજરી આપ્યા બાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. અમિત શાહના કાર્યક્રમમાં સંજોગોના કારણે અમિત શાહને દિલ્હી પહોંચવું પડે તેમ હતુ, જેના કારણે તેઓ કાર્યક્રમમાં ફેરફાર કરીને દિલ્હી જવાના રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મત વિસ્તારમાં લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમ કરવામાં આવ્યો છે. હવે અમિત શાહના બદલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓડા દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ, ખરીદ વેચાણ સંઘના ગોડાઉનનું ખાતમુહૂર્ત અને ઝોલાપુર તળાવનું લોકાર્પણ થશે. ગઈકાલે એટલે કે

સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતુ. ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત અમદાવાદમાં EWS ૫૮૮ આવાસોનું લોકાર્પણ કર્યું ઉપરાંત છસ્સા વિવિધ ૭ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપરાંત વાડજમાં AMCની નવનિર્મિત શાળાનું લોકાર્પણ કરી અમિત શાહે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. નવી શાળાઓની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતુ. તો વાડજમાં સ્વ. પ્રકાશચંદ્ર પાઠક માર્ગ નામકરણ કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા અને માર્ગના નામની તકનીકી અનાવરણ કર્યું હતુ.

દ્રૌપદી મુર્મૂ આજે વલસાડ જિલ્લાના ધરમપુરની મુલાકાતે

। (એજન્સી) વલસાડ, તા.૧૩ ।

દ્રૌપદી મુર્મૂ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા રાજચંદ્ર આશ્રમમાં પહોંચશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, આજે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં દ્રૌપદી મુર્મૂ મુલાકાતે

આવી રહ્યાં છે. અહીં ધરમપુર ખાતેના રાજચંદ્ર આશ્રમના એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે, આ દરમિયાન રાજ સભાગૃહનું ઉદઘાટન કરશે. દ્રૌપદી મુર્મૂ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા રાજચંદ્ર આશ્રમમાં પહોંચશે, અહીં એક

ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઉદઘાટન થશે. રાજચંદ્ર મિશન આશ્રમના ગુરુજી રાકેશજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યના ૮ જિલ્લાના આદીમ જૂથના લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિ સંવાદ પણ કરશે.

અમદાવાદમાં ફૂડ પોઈઝનિંગ મામલો આરોગ્ય વિભાગ દ્વારા મેરી ગોલ્ડ હોટેલ પર દરોડો પાડ્યો લગ્નમાં હાજર રહેલ ૪૪ થી વધુ લોકોને અસર પહોંચતા તમામ લોકોને સારવાર અર્થે અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી

। (એજન્સી) અમદાવાદ, તા.૧૩ ।

અમદાવાદનાં નિકોલમાં એસ.પી. રીંગ રોડ પર આપેલ વિશાલા લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલ મેરી ગોલ્ડ હોટેલમાં ગત રોજ ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો હતો. જેમાં ગઈકાલે લગ્નમાં હાજર રહેલ ૪૪ થી વધુ લોકોને અસર પહોંચતા તમામ લોકોને સારવાર અર્થે અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ સ્પુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા હોટેલની તપાસ શરૂ કરી હતી. ગત રોજ અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી. રાજીપીપળાથી આવેલા જાનૈયાઓ અને કન્યા પક્ષના મહેમાનો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. મેરીગોલ્ડ હોટેલમાં યોજાયેલા પ્રસંગમાં પિરસાયેલા ભોજન બાદ જાનૈયાઓની તબીયત બગડી હતી. મહેમાનોને વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસાયો હતો. મોડી રાત્રે કન્યાની વિદાય બાદ એક બાદ એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ૬ લોકોને ગંભીર અસર થતા મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કન્યાપક્ષના સંખ્યાબંધ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.

અમદાવાદમાં ફૂડ પોઈઝનિંગ મામલો આરોગ્ય વિભાગ દ્વારા મેરી ગોલ્ડ હોટેલ પર દરોડો પાડ્યો લગ્નમાં હાજર રહેલ ૪૪ થી વધુ લોકોને અસર પહોંચતા તમામ લોકોને સારવાર અર્થે અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી

બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં આગામી ત્રણ દિવસ પાણી કાપ સરહદી વિસ્તારના ત્રણ તાલુકાઓમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના ૮૩ જેટલા ગામોને પાણી આપવામાં નહીં આવે

। (એજન્સી) બનાસકાંઠા, તા.૧૩ ।

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આગામી ત્રણ દિવસ પાણી કાપ રહેનારો છે. વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના ૮૩ જેટલા ગામોને પાણી આપવામાં નહીં આવે. જેને લઈ તંત્રએ પણ વિસ્તારના લોકોને પાણી કાપને લઈ પાણીનો યોગ્ય જરૂરિયાત મુજબ સંગ્રહ કરવા માટે અપીલ કરી છે. પાણી પૂરવઠા દ્વારા સમારકામને લઈ પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. આગામી ૧૪ ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ત્રણ તાલુકાના લોકોને પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. બીકે-૨ યોજનાના ફિલ્ટર પ્લાન્ટ

સહિતના સમારકામને લઈ પાણીનો કાપ જાહેર કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પાણીની આ યોજના દ્વારા મળતો જળ જથ્થો બંધ રાખવામાં આવશે. બુધવારથી દેવપુરા ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય વોટર લાઈનનું સમારકામ હાથ ધરાનારા છે. લગભગ ૮૩ જેટલા ગામના લોકોને પાણીનો જથ્થો નહીં મળે. વાવ તાલુકાના ૩૮, સુઈગામના ૨૮ અને થરાદ તાલુકાના ૧૫ ગામોને આ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને અપીલ કરી છે. જે મુજબ જરૂરિયાત મુજબ પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે અને ઓછો વપરાશ કરવામાં આવે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદ તાલુકાના ઝોલાપુર ગામે તળાવનું લોકાર્પણ કર્યું

। (માહિતી) અમદાવાદ, તા.૧૩ ।

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઝોલાપુર ગામે તળાવનું લોકાર્પણ કર્યું હતું. લેક બ્યુટીફિકેશન અંતર્ગત કાયાકલ્પ થયેલ તળાવ મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો માટે ખુલ્લું મૂક્યું હતું. અહીં બાળકો માટે બાળ ક્રીડાંગણ પણ બનાવવાયો છે. આ ઉપરાંત અહીં કોમ્યુનિટી હોલ તથા સ્મશાન ગૃહનું પણ નવીનીકરણ કરાયું હતું. અંતે ઉલ્લેખનીય છે કે, યુ.એન.એમ ફાઉન્ડેશન (ટોરેટ ગ્રુપ)ના સહયોગથી ઝોલાપુર ખાતે તળાવ, બાળ ક્રીડાંગણ, કોમ્યુનિટી હોલ અને સ્મશાન ગૃહનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણ આશરે રૂા. ૩.૫૦ કરોડના ખર્ચે કરાયું છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, જિલ્લા ભ્રાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નવી આશા, નવી સફર, IVFની મદદથી આશાને ઉકિતમાં ફેરવો.

MERRYLAND

Women's Hospital & IVF (દેસ્ટ ટ્યુબ લેલી) સેન્ટર

રાહત હરે IVF પેકેજ/ઓપરેશન 0% વ્યાજદરે EMI સુવિધા ઉપલબ્ધ

કેમ્પ

કેમ્પ

દરેક ઈન્સ્યોરન્સ માટે કેશલેશ સુવિધાઓ ઉપલબ્ધ

સૌથી ઓછા પ્રયત્ને ૪૬પી ગર્ભધારણ માટે

- કારણ વગરના ઓવમપિક-અપ અને એમ્બ્રીયો ટ્રાન્સફરને રોકવા
- ઓછામાં ઓછા પ્રયત્ને ગર્ભધારણ મેળવવા
- ગર્ભપાતની શક્યતા ઓછી કરવા
- સૌથી સચોટ પદ્ધતિનો ઉપયોગ

નિશુલ્ક વ્યંધત્વ નિદાન કેમ્પ તા. ૧૫-૦૨-૨૦૨૪ સુધી સમય સવારે ૧૧ થી સાંજે ૬ સુધી

જટિલ સમસ્યાઓનાં નિવારણ માટે

- IUI કે IVF માં એકથી વધુ વાર નિષ્ફળતા
- 0% કે નહીવત શુક્રાણુ
- લાંબુ કે જટિલ વ્યંધત્વ
- ગમે તેવી મોટી ઉંમર કે નીચું AMH
- PCOD સહી બીજા ન બનવા કે છૂટા ન પાડવા
- બંને નળીઓ બંધ હોવી
- ગર્ભશયમાં ગાંઠ હોવી
- એન્ડોમેટ્રીઓસિસ
- એડેનોમાયોસિસ

ઉપલબ્ધ સેવાઓ

- દાર્શનિક પ્રેગનેન્સી ચુનિટ
- IUI, IVF સરોગેસી
- હિસ્ટ્રોસ્કોપી-લેપ્રોસ્કોપી
- દાર્શનિક પ્રેગનેન્સી
- મેલ/ફિમેલ ઈન્ફર્ટીલીટી

ડો. હિતેશ પટેલ રજીસ્ટ્રેશન ફિ પણ ફરજિયાત, તો કોલ કરો..
(ઈનફર્ટીલીટી સ્પેશ્યાલિસ્ટ) + 91 9081 66 33 55 / 66

સરનામું :- શ્રીજી માળ, ડ્રીમસ્કવેર, નિર્ણયનગર અંડરવીજની બાજુમાં, અખબારનગર, અમદાવાદ, ગુજરાત,
www.merrylandhospital.com